



યુસુફે મહેરા

ઈમામે મહદી (અ.સ.)

ભાગ : ૨

પ્રસ્તાવના

૧. નાફલા (નમાઝે શબ), ઝીયારતે આશુરા, ઝીયારતે જામેઆ પડવાની તાકીદ

૨. ૧૦ વર્ષના બાળકને શિક્ષા મળી.

૩. બહરૂલ ઓલુમ (અ.ર.)ને ઈમામ અ.સ.ની મુલાકાત

૪. મુલાકાતનો દાવો ન કરવો જોઈએ.

૫. મા-બાપને ખુશ રાખો.

૬. એક આલિમે દિનને ઈમામ અ.સ.ની મુલાકાત.

૭. હઝરતની ઇનાયતથી પત્નીને શિક્ષા મળી.

૮. દાડમનો પ્રસંગ

૯. ઇમામે વકત મોઅમીનોની પનાહગાહ છે.

૧૦. મુકદ્દસે અદબેલી (અ.ર.)ને ઇમામની મુલાકાત.

૧૧. શેખ મુર્તઝા અન્સારી (અ.ર.)ને ઇમામ અ.સ.ની મુલાકાત

૧૨. ઝવ્વારે ઇમામ અ.સ.ને પરેશાન કરનાર ખાદીમનો અંજામ.

૧૩. આંખથી થતા ગુનાહથી બચવાને
કારણે ઈમામ અ.સ. થી મુલાકાત.

૧૪. ઈમામ અ.સ.ની સલામતી માટે
સદકો કાઢ્યો.

૧૫. અબુ મોહમ્મદ અંધ થઈ ગયો.

૧૬. ઈબ્રાહીમ ઈબ્ને મહેઝીયારને
ઈમામ અ.સ.ની મુલાકાત

૧૭. પતિ-પત્નીના મતભેદનું
સમાધાન

૧૮. શેખ મુફીદ અ.ર.ને ઈમામ
અ.સ.નો પત્ર.

૧૯. ઇમામ અ.સ.ને દરેક વસ્તુની માહિતી છે.

૨૦. પગના ઝખમમાંથી શિક્ષા મળી.

૨૧. હાજી અલી બગદાદીને ઇમામ અ.સ.ની મુલાકાત

૨૨. ગયબતે ઇમામ અ. માં આપણી જવાબદારી : ઇમામ હુસૈન અ. પર રડવું

૨૩. આપણી ઇમામ અ. પ્રત્યેની ફરજ:ઇમામના વિયોગના દુઃખમાં શોકમગ્ન બનવું.

૨૪. આપણી ત્રીજી જવાબદારી :
ઇત્તેઝાર

૨૫. ઇમામે અસ્ર અ.ના શિયાઓ
સાથ દોસ્તી કરવી અને મદદરૂપ
થવું.

૨૬. ઇમામે ઝમાના અ.સ.ની ખુશી
માટે ખર્ચ કરવો.

૨૭. ઇમામ અ.ને દિલથી ચાહવા અને
કલામ થકી ઇમામ અ.ની મદદ
કરવી.

૨૮. પવિત્ર ઇમામો અ.મુ.સ.ની
પ્રશંસામાં કલામ રચવા.

૨૯. ઇમામ અ.સ.માટે દુઆ કરવી.

૩૦. ઇમામે ઝમાના અ.સ. માટ દુઆ કરવાના કેટલાક ફાયદાઓ.

૩૧. ઇમામે ઝમાના અ.સ. માટે કેટલીક દુઆઓ.

૩૨. નઝમ

પ્રસ્તાવના

હાલમાં આપણા ઈમામે ઝમાના અ.સ. ગયબતમાં છે, તેનો મતલબ એવો નથી કે ઈમામ અ.સ. આખી દુનિયાથી સાવ અલગ થઈ એકાંતમાં કોઈ અજ્ઞાત સ્થળે જુંદગી વીતાવે છે. ગયબતનો અર્થ એ છે કે લોકોને ઈમામ અ.સ. ના રહેઠાણનું જ્ઞાન નથી. અગર તેઓ ઈમામ અ.સ. ને જુએ તો પણ તેમને ઓળખી શકતા નથી. ઈમામ સાદિક અ.સ. એક હદીસમાં ફરમાવે છે : “લોકો તેમને જુએ છે પણ તેમને ઓળખી શકતા નથી” (મુન્તાખબુલ અસર ભાગ-૨, પા. ૩૦૧). આપણે આપણી ગુનેહગાર નજરોથી ઈમામને તો નથી જોઈ શકતા પરંતુ

ઈમામ અ.સ. આપણને જરૂર જોઈ રહ્યા છે. અગર કોઈને આ વાતનો અહેસાસ થાય કે દરેક પળે ઈમામ અ.સ.ની નજરોની સમક્ષ છે તો ઘણાબધા ગુનાહોથો બચો જશે. ફક્ત નેક કાર્યોજ ઈમામ અ.સ.ની નઝદીકીનું કારણ છે.

ઈમામે ઝમાના અ.સ. અદ્દાહનો દરવાજો (બાબુદ્દાહ) છે અને અસ્માઉદ્દાહ (અદ્દાહનુંનામ) પણ છે. અગર આપણે આ મહત્વપૂર્ણ વસીલાની મદદથી દુઆ માગીશું તો દુઆઓ કબુલ થશે.

ઈ. રેઝા અ.સ. ફરમાવે છે કે ઈમામ એક મદદગાર છે, એક દોસ્ત છે, એક વાત્સલ્ય ભર્યા પિતા છે, એક ચાહનારા ભાઈ છે, એક એવી મા છે જે પોતાના નાનકડા બાળકને

ભરપુર પ્યાર કરે છે (ઉસુલે કાફી ભાગ - ૧ પે.
૨૦૦)

યકીનન ઈમામ અ.સ. આપણને સગા
મા-બાપ કરતા પણ વધુ ચાહે છે. તકલીફમાં
આપણે ઈમામ અ.સ. ને તકલીફ જણાવવી
જોઈએ. ઈમામ અ.સ. ની શક્તિ અને તાકાત
ઉપર એક નજર કરીએ તો ઈમામ અ.સ. આ
દુનિયાના પટ ઉપર અદ્વાહની હુજજત છે.
આપણને એ વાતનો વિશ્વાસ હોવો જોઈએ કે
આપણા ઈમામ અ.સ. આપણી મદદ કરશે
કારણ કે એક મહેરબાન પિતાને પોતાના
પરેશાન પુત્રની હાજતો પુરી કરવામાં આનંદ
થશે.

કિસ્સો - ૧

નાફેલા (નમાઝે શબ), ઝિયારતે
આશુરા, ઝિયારતે જામેઆ પડવાની
તાકીદ

સાલેહ તકી સૈ. હાશીમ મુસવી તાઝીર સાકીન રશતથો રિવાયત કરેલ આ પ્રસંગને નજમુસ્સાકીબ નામની કિતાબમાં લખવામાં આવ્યો છે. તેઓ વરઅ અને તકવામાં બહુ મશહુર હતા. ઈબાદતગુઝાર ઈતાઅતગુઝાર અને ઝીયારત અને હકકોની અદાયગીમાં પાબંદ હતા. તેઓ બયાન કરે છે કે હિ. ૧૨૮૦ માં હું હજજે બૈતુલાહનાં ઈરાદાથી લબરેઝ આવ્યો હતો. અને હું હાજી સફરઅલી તાજીર

તબરેજીના ઘરે મહેમાન તરીકે રહ્યો. આ દિવસોમાં હજ માટે કોઈ કાફલો જવાનો ન હોવાથી હું થોડા દિવસ ત્યા મહેમાન તરીકે રહ્યો. ત્યા સુધી કે હાજી હબ્બાર જુલૂદાર થોડો સામાન લઈને મકામે તરબુઝ જતા હતા. હું પણ તેમની સાથ સવારી ભાડે કરીને ચાલવા લાગ્યો.

ખ્યાલ એ હતો કે કોઈ કાફલો આગળ જઈ રહ્યો છે અને ભયંકર (ડરામણો) રસ્તો આવવાનો છે. તેથી અમે જલદી રવાના થવાનું નક્કી કર્યું અને સુબ્હથી ત્રણ કલાક પહેલા રાત્રે રવાના થયા. હજી થોડું અંતર કાપ્યું હતું ત્યા તો આસમાનમાંથી સખ્ત બરફનો વરસાદ શરૂ થઈ ગયો. મારા સાથીઓએ ચેહરા ઢાંકી

દીઘા અને ઝડપથી અગળ વઘવા લાગ્યા. મે કોશીષ કરી. પરંતુ હું સાથ રહી શક્યો નહીં, અને પાછળ રહી ગયો. એટલે સુધીકે હું ઘોડા ઉપરથી ઉતરીને એક જગ્યાએ બેસી ગયો. તે સમયે હું એકલો અને ડરેલો હતો. મારી પાસે ૬૦૦ તુમાન હતા. ઘણુ વિચાર્યા પછી નક્કી કર્યુ કે સવાર સુધી અહીં રહીશ. પછી મારા સ્થળે પાછો ફરી જઈશ. અને કેટલાક સાથોઓને હીફાઝત માટે સાથ લઈશ. આ સોચ વિચારમાં મેં મારી સામે એક બાગ (બગીચો) જોયો, અને જોયુ કે તેમાં એક સાહેબ વૃક્ષ પરથી બરફ સાફ કરી રહ્યા છે. મને જોઈને તેઓ મારી પાસે આવ્યા અને થોડા દુર ઉભા રહીને મને પુછ્યુ. “તમે કોણ છો ?”

મે કહ્યુ “મારા સાથોઓ આગળ ચાલ્યા ગયા છે, અને હું એકલો પડી ગયો છું, અને રસ્તો મને મળતો નથી.” તેમણે ફરસી ભાષામાં, મને કહ્યુ, “નાફેલા (નમાઝે શબ) પઢો, રસ્તો મળી જશે.” તેમનું ફરમાન સાંભળીને હું નાફેલા (નમાઝે શબ) પઢવા લાગ્યો. મે નમાઝે તહજજુદ (નમાઝે શબ) પુરી કરી, ત્યા તે સાહેબ ફરી મારી પાસે આવ્યા, અને ફરમાવ્યુ કે “તમે હજી નથી ગયા ?” મે કહ્યુ, “રસ્તો નથી જાણતો, ક્યાં જાઉ ?” ફરમાવ્યુ કે “જમેઆ (ઝીયારતે જમેઆ) પઢો.” પરંતુ મને ઝીયારતે જમેઆ યાદ ન હતી. પરંતુ હુ ઘણી વખત આ ઝીયારત પઢતો હતો. તેથી મે ઝીયારત પઢવાનું શરૂ કર્યુ અને પુરી

ઝીયારત પઢી લીધી. ત્યારે ફરી વખત તે સાહેબ આવ્યા અને કહ્યુ, “તમે અહીજ છો, ગયા નથો.” તે સમયે હું બે ઈપ્તેયાર રડવા લાગ્યો અને કહ્યુ કે “હું શું કરૂં, હું રસ્તોજ નથો જાણતો” તેમણે ફરમાવ્યુ “ઝીયારતે આશુરા પઢો.” પરંતુ ઝીયારતે આશુરા પણ મને ઝબાની યાદ ન હતી. પરંતુ મે પડવાનું શરૂ કર્યુ તો મે પુરી ઝીયારત લાઅનત, સલામ, અને દુઆ સાથ પઢી લીધી. તો ફરી વખત તે બુર્જુગવાર મારી પાસે આવ્યા અને કહ્યુ, “તમે ગયા નથો, હજી અહી જ મૌજુદ છો ?” મે મારી મજબુરીનો ઈઝહાર કર્યો. ત્યારે તેઓએ ફરમાવ્યુ, “સારૂં, હું તમને તમારા કાફલા સુધી પહોંચાડી દઉં છું.” તેઓ

સવારી પર સવાર થયા અને મને કહ્યુ કે પાછળ બેસી જાઓ. હું બેસી ગયો, અને મારા ઘોડાની લગામ ખેંચી, પરંતુ તે જગ્યાથી હરકત ન કરી. તેમણે કહ્યુ કે “લગામ મને દયો” મે લગામ તેમના હાથમા દીધી, ઘોડો તેમની જાતે ચાલવા ગયો અને અમે રસ્તા ઉપર આવી ગયા.

ચાલતા જ તેઓએ મારા ઝાનુ (ગોઠણ) ઉપર હાથ રાખીને હીંદાયત કરી, કે તમે નાફેલા (નમાઝે શબ) શા માટે નથી પઢતા ? નાફેલા, નાફેલા, નાફેલા, ત્રણ વખત ફરમાવ્યુ. પછી તેજ રીતે હુકમ આપ્યો કે ઝીયારતે આશુરા શા માટે નથી પઢતા. (ઝીયારતે) આશુરા, આશુરા, આશુરા પછી હીંદાયત કરી કે

(ઝીયારતે) જામેઆ શા માટે નથો પઢતા. જામેઆ, જામેઆ, જામેઆ. તે વખતે રસ્તો ઝડપથો પસાર થઈ રહ્યો હતો, એકાએક ફરમાવ્યુ કે સામે તમારા સાથોદારો છે. જેઓ નદી કીનારે નમાઝે સુબ્હ માટે વુઝુ કરી રહ્યા છે. આટલુ કહીને તેઓએ મને સવારી ઉપરથો ઉતારી દીધો. ત્યાર પછી હું મારા ઘોડા ઉપર સવાર થવા ઈચ્છતો હતો, પરંતુ સવાર ન થઈ શક્યો. તેઓ ખુદ ઉતર્યા અને મને સવાર કરીને ઘોડાના ચહેરાને એ તરફ કરી દીધો જે તરફ મારા સાથોઓ હતા. તે સમયે મને ખ્યાલ આવ્યો કે આ સાહેબ (બુર્કુગવાર) કોણ છે, જેણે મારી સાથ ફારસી માં વાત કરી. જો કે આ વિસ્તારમાં આ ભાષા બોલાતી નથો. અને

કેટલી મહેરબાનીથી તેઓએ મને મારા દોસ્તો
(સાથોઓ) થી મુલાકાત કરાવી દીધી. હવે હું
જોઉ છું તો તે સાહબ (ઇ. ઝમાના હ. મહદી
અ.સ.) ગાએબ થઈ ગયા અને કોઈ નિશાન
પણ દેખાતુ ન હતું. ત્યાર પછી હું મારા
સાથોઓ પાસે પહોંચી ગયો (ઈરફાને
ઈમામત, કિસ્સો - ૪૬)

કિસ્સો - ૨

૧૦ વર્ષના બાળકને શિક્ષા મળી

વસ્સાએલુશીઆ અને બીજી કેટલીક
ઈલ્મી કિતાબોના લેખક મહાન આલિમે દીન
મ. શેખ હુર્રે આમેલી અ.ર. કિતાબ
અસ્બાતુલ હોદા માં લખે છે કે

“હું લગભગ ૧૦ વર્ષનો હતો, ત્યારે એવો બિમાર પડી ગયો કે હકીમો અને ડોક્ટરો મારા ઈલાજ કરવાથો થાકી ગયા. મારા દોસ્તો અને સગા સંબંધીઓ મારી પથારીની આજુબાજુ ભેગા થઈ ગયા હતા, અને મારા મૌતના ઇંતેઝારમાં હતા. તેઓને ચકીન થઈ ગયું હતું કે હું મરી જઈશ. તેઓ રડવામાં મશગુલ હતા.

આ રાત્રે મેં સ્વપ્નમાં હ. રસુલે ખુદા સ.અ.વ. તથા બાર ઈમામોની ઝીયારત કરી. મેં જોયું કે તેઓ મારી આજુબાજુમાં ઉભા છે.

મેં તેઓની ખીદમતમાં સલામ કરી અને દરેકની સાથે મુસાફરો કર્યો. હ. ઈ. જાફરે સાદિક અ.સ. અને મારી વચ્ચે વાતચીત થઈ,

જે મને અત્યારે યાદ નથી. પરંતુ મને એટલું યાદ છે કે આપ હઝરત અ.સ. એ મારા હકકમાં દુઆ કરી અને જ્યારે મેં હ. ઇમામે વલીએ અસ્ર અરવાહુલ આલમીન લહુલ ફીદા (ઇમામ મહદી અ.સ.) ની સાથ મુસાફરો કર્યો, ત્યારે મે રડતા રડતા અર્ઝ કરી કે મને ડર લાગે છે કે કદાચ હું આ બિમારીમાં મરી જઈશ, અને ઇલ્મ હાંસીલ કરવાનો મારો ઇરાદો પુરો નહીં થાય.

આપ (ઇમામ મહદી અ.સ.) એ ફરમાવ્યું, “ડરો નહીં તમને આ બિમારીથી મૌત નહીં આવે, અદ્દાહ (ત.ત.) તમને શીફા આપશે તમારી લાંબી ઝીંદગી થશે.” ઇમામ અ.સ. ના હાથમા પાણીનું એક વાસણ હતું.

તેઓએ મને દીધુ અને પાણી પીવા કહ્યુ મે તરતજ તે પાણી પીધુ. તો તરતજ મને શિક્ષા (તંદુરસ્તી) મળી ગઈ અને મારી બિમારી પુરે પુરી ખત્મ થઈ ગઈ. મારા સગાસંબંધીઓ જેઓ ત્યા બેઠા હતા, તેમને ખુબ નવાઈ લાગી, અને તેઓ અચંબામાં પડી ગયા ત્યા સુધી કે મે અમુક દિવસો પછી પ્રસંગ બયાન કર્યો. (મુલાકાતે ઈ. ઝમાના અ.સ. ભા.-૧ કિસ્સો પર પે. ૨૫૦)

કિસ્સો - ૩

બહરૂલ ઓલુમ અ.ર. ને ઈમામ અ.સ.

ની મુલાકાત

મશહુર કિતાબ મુન્તહુલ અઅમાલમાં મોહઘીસે કુમ્મી, અઘામા જલીલુલ કદ્ર

આલિમ ઝયનુલ આબેદીન સલમાસી અઘામા બહરુલ ઉલુમ (રહ.) ના પ્રબંધ કર્તા થો મનકુલ છે કે : જે સમયે અઘામા બહરુલ-ઉલુમ (ર.) મકકાએ મોઅઝઝમાં માં રહેતા હતા, અને હનફી, શાફેઈ, હમ્બલી, અને માલેકી, આલીમોને દર્સ આપી રહ્યા હતા. તે વખતે આપની બક્ષીસ અને અતાઓના કારણે આપનો ખર્ચ બહુજ વધી ગયો હતો. ખર્ચ બહુજ વધી જવાના લીધે મારી પાસે એક પૈસો પણ ન હતો મે સૈયદને અર્ઝ કરી કે ખર્ચ એટલો બધો છે પરંતુ મારી પાસે એક પાઈ પણ નથી. આપે કાંઈ જવાબ ન આપ્યો. આપનો નિત્યક્રમ એ હતો કે આપ સવારે ખાનએ કાબામાં તવાફ માટે તશરીફ લઈ જતા

પછી ઘરે પાછા ફરીને પોતાના ખાસ ઓરડામાં જતા, ત્યાં જઈ હુકકો પીતા. ત્યાર પછી ત્યાથો બહાર આવીને બીજા ઓરડામાં જતા જ્યાં વિવિધ પંથના વિદ્યાર્થીઓ ભેગા થતા અને તે દરેકને તેમનાજ પંથ મુજબ તેઓને દર્સ આપતા. હું આગલા દિવસે તેઓને તંગદસ્તીની ફરીયાદ કરી ચુક્યો હતો, તે પછી તવાફ કરીને આવ્યા પછી હજુ તો મે તેઓની ખીદમતમાં હુકકો રજુ જ કર્યો હતો ત્યા અચાનક કોઈકે બારણે ટકોરો માર્યો મે જોયુ કે ટકોરાનો અવાજ સાંભળીને સૈયદ એકદમ બેચેન થઈ ગયા અને ફરમાવયું : કે અહીંથી હુકકો બહાર લઈ જાવ, અને પોતે ઝડપથી ઉભા થઈને બારણુ ખોલી નાખ્યું. મે જોયુ કે

અરબનો પોશાક પરિધાન કરેલા એક જલીલુલકદ્ર શખ્સ પધાર્યા, ઓરડામાં આપીને સૈયદના ઓરડામાં બેસી ગયા. સૈયદ ખુબજ આજેઝી અને નમ્રતા સાથ અદબ પુર્વક દરવાજા પાસે ગયા. તેઓએ મને હુકકો પાસે ન લાવવાનો ઇશારો કર્યો. સૈયદ અમુક સમય સુધી તેઓ સાથ વાતચીતમાં મશગુલ બેસી રહ્યા. ત્યાર પછી તે શખ્સ ઉભા થયા. સૈયદે તુરંતજ ઉભા થઈ દરવાજો ખોલ્યો, તે શખ્સના હાથને ચુમ્યા અને દરવાજા પાસે ઉભા રહેલ ઉટ ઉપર તેઓને સવાર કર્યા. તે શખ્સ ચાલ્યા ગયા. સૈયદ પાછા ફર્યા ત્યારે તેઓના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. તેઓએ મારા હાથમાં એક ચીઠ્ઠી આપીને ફરમાવ્યુ કે આ હવાલો છે

તેને સફા અને મરવાની પહાડીઓની વચ્ચે રહેતા શરાફને આપ, અને તેના બદલામાં ત જે કાંઈ આપે તેને લઈ આવો. મે તે ચીઢી લઈ જઈ ને શરાફના હાથમાં આપી. તે શરાફે તે ચીઢી હાથમાં લઈને ચુંબન કર્યું અને કહ્યું : કે જાવ થોડા મજૂર લઈ આવો હું મજૂર ને લઈ આવ્યો. મજૂરોએ શક્ય તેટલા ફાંસીસી રીયાલ (ફાંસના સીકકા) ઉઠાવી લીધા. હું મજૂરોને લઈ પાછો ફર્યો હું એક દિવસ તે શરીફને મળવા માટે સફાના પહાડ ઉપર ગયો ત્યા મકાન કે કોઈ શરાફની દુકાન ન હતી. મે ત્યા આજુબાજુ રહેતા લોકોને પુછ્યુ તો જાણવા મળ્યુ કે : તેવા કોઈ શરાફને જોયો નથો કે ન તો તેઓ શરાફ વિશે કાંઈ જાણે

છે.હું સમજી ગયો કે ખુદાના રહસ્યો પૈકીનું આ એક રહસ્ય છે. (ઈરફાને ઈમામત, કિસ્સો - ૩૧)

કિસ્સો - ૪

મુલાકાતનો દાવો ન કરવો જોઈએ

અધામા બહરૂલ ઓલુમનો બીજો એક મહત્વનો પ્રસંગ છે. અધામા મજલીસી (ર.) નોંધે છે કે : આકાએ ઝૈયનુલ આબેદીન સલમાસીનું બયાન છે કે : હું અધામા બહરૂલ ઓલુમ (ર.) ની બેઠકમાં હાજર હતો, ત્યારે એક માણસે તેઓને પ્રશ્ન કર્યો કે ગયબતે કુબરાના ઝમાનામાં અ.ત.ફ.શ. ના દીદાર થવા શક્ય છે ? તે વખતે બહરૂલ ઓલુમ (ર.) ના હાથમાં હુકકાની નળી હતી. તેઓએ

મસ્તક ઝુકાવી દીધુ અને આ પ્રમાણે ઘીમેથા બોલ્યા, જે મે સાંભળ્યુ :

આ માણસને હું શું જવાબ આપુ ?
હકીકતમાં તો ઇ. ઝમાના અ.સ. મને આલીંગન આપી (છાતી સરસા ભેટી) ચુક્યા છે. બીજી બાજુ હદીસમાં વારીદ થયુ છે કે : જે માણસ ગયબતના ઝમાનામાં (તેઓ અ.સ.) ને જોવાનો દાવો કરે તેને જુઠલાવી દો. ત્યાર પછી ઓલમાએ આ વાત ઘણી વખત ઉચ્ચારી. ત્યાર પછી પૂછનારને જવાબ આપતા ફરમાવ્યુ : માઅસુમીન અ.સ.ની હદીસોમાં વારીદ થયુ છે કે હ. હુજજત (અ.ત.ફ.શ.) ને જોવાનો દાવો કરનારને જુઠલાવી દો. અદ્દામાએ તે માણસના

જવાબમાં ઉપરના વાક્ય સિવાય બીજું કંઈ ન કહ્યું, અને તેના જવાબમાં આ વાક્ય પુરતું સમજ્યું. આ બનાવથી એ વાત જાણવા મળે છે કે : હ. ઈમામે ઝમાના (અજ.) ના દીદાર થવા શક્ય છે, પરંતુ (તેઓ અ. ને જોવાનો) દાવો હરગીઝ ન કરવો જોઈએ. તેનાથી કોઈ ખોટી દાનતવાળાને પોતાની દુકાન જમાવવાની તક પ્રાપ્ત થાય છે. (અલ મુન્તાઝર ,હી.સ. ૧૪૧૫ પે. નં. ૧૮)

ક્રિસ્તો - ૫

મા-બાપ ને ખુશ રાખો

બેહારના ૫૩ માં પુસ્તકના પાના નંબર ૨૪૫ માં અદ્દામા મજલીસી નોંધે છે કે : શેખ બાકર કાઝમીનું બયાન છે કે : એક સાદિક

અને સાલેહ શખ્સ હતો જે બહુજ નેક માણસ હતો. તેના પિતા વૃદ્ધ હતા. તેણે પોતાના વૃદ્ધ પિતાની સેવા કરવામાં કદી ગફલત કરી ન હતી. તે તેના વૃદ્ધ પિતાની એટલી બધી સેવા કરતો કે તેના પિતા કુદરતી હાજત માટે જતા ત્યારે તે લોટાની જગ્યાએ લોટો મુકી દેતો. અને જ્યાં સુધી તેના પિતા અંદર રહેતા ત્યાં સુધી બહાર ઈન્તેઝાર કરતો. તે ક્યારેય પણ તેના પિતાથી દુર ન રહેતો અને હંમેશા પોતાના પિતાની ખીદમત કરવા માટે તત્પર રહેતો હતો. તે માણસ ફક્ત મંગળવારે સાંજે (એટલે બુધવારની શબ) મસ્જીદે સહેલામાં જતો અને તુરંતજ પાછો ફરી જતો મેં તેને મસ્જીદ જલ્દી છોડવાનું કારણ પુછ્યુ ત્યારે

તેણે કહ્યુ : હું ચાલીસ મંગળવાર (બુધવારની શબ સુધી) મસ્જીદે સહેલા ગયો. જ્યારે ૪૦ માં મંગળવારે જવા માંગતો હતો, ત્યારે મગરીબના સમયે ત્યા જવાનું શક્ય ન બન્યુ. ત્યા જવા માટે એકલો રવાના થયો. ચાંદની રાત હતી, હું થોડોક જ આગળ વધ્યો હતો અને ત્રીજા ભાગનો રસ્તો હજુ બાકી હતો, તેવામાં એક અઅરાબીને જોયા. તેઓ ઘોડા ઉપર સવાર હતા. અને મારી તરફ આવી રહ્યા હતા. મે મારી જાતને કહ્યુ કે : આ માણસ મને (લુટીને) નિર્વસ્ત્ર કરી નાખશે. તે મારી પાસે પહોંચ્યો. તેણે મારી સામે ગામઠી ભાષામાં વાતચીત કરી અને હું કંઈ જગ્યાએ જાવ છું તે પુછ્યુ. મેં કહ્યુ કે મસ્જીદે સહેલામાં જઈ રહ્યો

છું. તેણે પુછ્યુ : તારી પાસે ખાવા પીવાનું કંઈ છે ? મેં કહ્યુ ના. તેણે કહ્યુ કે : તારા ખીસ્સામાં હાથ તો નાખ. (આ વાક્ય તેણે ગામઠી ભાષામાં કહ્યુ) મેં કહ્યુ : મારા ખીસ્સામાં કાંઈજ નથી. તેણે ફરીવાર તેજ વાત કરી. મેં મારા ખીસ્સામા હાથ નાખ્યો. જેમા થોડા કીસમીસના દાણા હતા. જે મેં મારા બાળકો માટે ખરીદ્યા હતા. અને તેને ખીસ્સામાં નાખીને ભુલી ગયો હતો, જે હજી સુધી ખીસ્સામાં પડ્યા હતા.

તે પછી અઅરાબીએ મારી તરફ મુખ ફેરવીને ત્રણ વખત આ પ્રમાણે કહ્યુ : ઉસીક બીલ અવદ (અરબ બદદુની ગામઠી ભાષામાં વૃદ્ધ પિતાને અવદ કહેવાય છે) એટલે કે હું

તારા વૃદ્ધ પિતા વિશે વસીયત કરૂ છું. આટલુ કહીને મારી નજરોથી ગાએબ થઈ ગયા. ત્યારે મને સમજણ પડી કે તેઓ હ. હુજજત અ.સ. છે અને હું મારા વૃદ્ધ પિતાથી જુદો થાવ તે વાતથી તઓ રાજી નથી. એટલે સુધી કે હું મંગળવારની રાત્રે (બુધવારની શબે) પણ મારા પિતાથી જુદો થાવ તે વાત તેઓને પસંદ નથી. (ઈસ્કાને ઈમામત, કિસ્સો - ૧૫)

કિસ્સો - ૬

એક આલિમે દીનને ઈમામ અ.સ. ની

મુલાકાત

કિતાબે મસાબીહમાં હાજી આકા રઝા હમદાની બયાન કરે છે કે : હ. હુજજત અ.ત.ફ.શ. ક્યારેક પોતાના ખાસ શિઆઓ

સમક્ષ પોતાને જાહેર કરે છે. દા.ત. ૫૦ વર્ષ પહેલા એક અત્યંત પાકીઝા સીરત વાળા આલીમ અ.રહીમ દમાવંદી સાથ મુલાકાત કરી હતી. તેઓનું બયાન કરે છે કે હું મારા ઘરમાં રાત્રે બેઠો હતો. તે આટલી બધી અંધારી રાત હતી કે હાથ પણ સુજતા ન હતા. તે રાતે મે હઝરત અ.સ. ની ઝીયારત કરી. હઝરત કીબલા તરફ ઉભા હતા. આપના તેજસ્વી ચહેરા પરથી નુર ફેલાતુ હતી. તે નુર એટલુ બધુ પ્રકાશીત હતુ કે જમીન ઉપર બીછાવેલ પાથરણા પર કરવામાં આવેલી આકૃતિ પણ જોઈ શકાતી હતી.

(અલ મુન્તઝર હી.

૧૪૧૫, પેજ નં. ૧૯)

કિસ્સો - ૭

હઝરતની ઇનાયતથી પત્નીને શિક્ષા મળી.

હુજજતુલ ઇસ્લામ વલ મુસ્લેમીન આકાએ હાજ શેખ મોહમ્મદ મુત્તકી હમદાની, જેઓના તકવા અને પરહેઝગારી જાણીતી હતી, તેઓએ નોંધ્યુ છે કે : તેઓની પત્ની અર્ધબેહોશીની હાલતમાં હતી ઇલાજ કરનારાઓ તેણીની સારવાર કરીને નીરાશ થઈ ચુક્યા હતા. એટલે સુધી કે ૨૨ સફર ૧૩૯૭ ના રોજ આકાએ મુત્તકીએ અડધી રાતે બારગાહે હઝરતમાં ફરીયાદ કરી. અને તેથી હઝરત અ.સ.ની ઇનાયતથી તેમની પત્નીએ પુનઃ તંદુરસ્તી પ્રાપ્ત કરી. આ પ્રસંગનું

આકાએ મુત્તકીએ પોતે વિગતવાર વણાંન કર્યું છે.(અલ મુન્તઝર હી. ૧૪૧૫, પેજ નં. ૧૯)

કિસ્સો - ૮

દાડમનો પ્રસંગ

અત્રે એક બનાવ પ્રસ્તુત કરીએ છીએ છીએ. જેનાથો ઇમામે (અ.) બેહરૈનના શિયાઓની મદદ કેવી રીતે કરી હતી તે સમજાય છે. બેહરૈન શહેર અંગ્રેજો ના કબ્જામાં હતું. અંગ્રેજો એ ત્યાંના હાકિમ તરોકે એક મુસ્લીમની નિયુક્તી કરી હતી. બેહરૈનનો હાકિમ નાસબી હઝરત અલી અ.નો વિરોધી હતો. તેના દરબારમાં જે વઝીર હતો, તે તેની કરતા પણ પક્ષપાતી વલણ ધરાવતો હતો. બહરૈનના રહેવાસીઓની વસ્તીનો મોટોભાગ

એહલેબૈત (અ.મુ.સ.)ના ચાહવાવાળા શિયાઓનો હતો. વઝીર તે લોકોનો સખ્ત દુશ્મન હતો. અને એવું ઈચ્છતો હતો કે ગમે તેમ કરીને શિયાઓની વસ્તી ખત્મ થઈ જાય. આ માટે હંમેશા કંઈકને કંઈક બહાના શોધ્યા કરતો હતો. એક વખત વઝીર એક દાડમ લઈને દરબારમાં ગયો. અને હાકીમ સમક્ષ દાડમ રજુ કર્યું. દાડમની છાલ પર લખેલું હતું : ‘ લાએલાહ ઈલ્લાહ મોહમ્મદુર રસુલુલ્લાહ અબુબકર, વ ઉમર વ ઉસ્માન વ અલી ખોલફાઓ રસુલીલ્લાહ’ હાકીમે તે દાડમને ધ્યાનથી જોયું. તેને આ અક્ષરો કુદરતી રીતે જ લખાયા હોવાનું લાગ્યું અને આ અક્ષરો કૃત્રિમ રીતે લખાયા હોવાનો અણસાર સુધ્ધા ન

આવ્યો. આ જોઈને હાકીમ વજીરને કહ્યું કે આ બહુજ સ્પષ્ટ દલીલ છે કે રાફઝીઓનો મઝહબ બાતિલ છે. આ બાબતમાં તમારો શો અભિપ્રાય છે ? વઝીરે તુરંતજ જવાબ આપ્યો કે : આ શિયાઓ (મઝહબી બાબતોમાં) પક્ષપાતી સમુહ છે. અને સ્પષ્ટ દલીલોનો પણ ઈન્કાર કરે છે. આપ હુકમ કરો તો બધા શિયાઓને અહીં ભેગા કરીને આ દાડમ દેખાડીએ. આ જોઈને તેઓ આપણો (ગૈર - શિયા) મઝહબ સ્વીકારી લેશે. તો આપણને બધો જ સવાબ મળશે. અને જો તેઓ આપણો મઝહબ સ્વીકારવાનો ઈન્કાર કરે તો તેમની સામે ત્રણ શરતો રજુ કરવી. અને હુકમ

આપવો કે આ ત્રણમાંથી કોઈ એક શરત કબુલ કરો.

પહેલી શર્ત :- ચઠ્ઠીઓ અને ઈસાઈઓની જેમ ટેક્ષ (મોટી રકમ કરવેરા રૂપે) આપે.

બીજી શર્ત :- આ સ્પષ્ટ દલીલોનો જવાબ લાવે, જે તેમના ગજા બહારની વાત છે.

ત્રીજી શર્ત :- તેઓમાંના પુરૂષોને કતલ કરી નાખવામાં આવે, તેમની સ્ત્રીઓ અને બાળકોને કેદી બનાવવામાં આવે અને તેમની મિલકત જપ્ત કરવામાં આવે. હાકીમે વઝીરની આ વાતને સ્વીકારી લીધી અને તુરતજ શિયા આલીમો અને બુઝુર્ગોને દરબારમાં બોલાવવામાં આવ્યા. તેઓને લખાણવાળુ

દાડમ દેખાડવામાં આવ્યું એનો સંતોષકારક જવાબ આપવાનું કહેવામાં આવ્યું અને તેઓ જવાબ ન આપી શકે તો ત્રણ શરતો રજૂ કરવામાં આવી. તે દાડમ જોઈને શીયા આલીમો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને તેનો જવાબ આપી ન શક્યા, તેઓના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમના શરીર ઘુજવા લાગ્યા અને તેમના પગ નીચેથી ઘરતી સરકવા લાગી. શિયા બુર્જુગોઅ હાકીમ પાસેથી ત્રણ દિવસની મુદત માંગી અને કહ્યું કે જો તેઓ ત્રણ દિવસમાં કોઈ જવાબ લાવી ન શકે તો હાકીમને યોગ્ય લાગે તે કરવાનો અધિકાર છે. મુદત મળી ગઈ. તમામ શિયાઓની મીટીંગ મળી. જેમાં તેઓમાંથી

દસ મુત્તકી, પરહેઝગાર આલીમોને પસંદ કરી તેમાથી ત્રણ આલીમોને પસંદ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ક્રમાનુસાર ત્રણેય આલીમે જંગલમાં જઈને ઈમામે ઝમાના (અ.સ.) ના વસીલાથી ખુદા પાસે મદદ માંગવી. તેઓમાંના એકે જંગલમાં જઈને સવાર સુધી ઈબાદત મુનાજાત અને દુઆઓમાં રાત ગુઝારી. તેમણે સવારે પાછા આવીને શિયા બુઝુર્ગોને ખબર આપી કે કોઈ ઉકેલ ન મળ્યો. બીજી રાતે, બીજા આલીમે જઈને તેઓજ અમલ કર્યો. તેમનેય ઉકેલ ન મળ્યો. ત્રીજી રાતે મોહંમદ બીન ઈસા નામના ત્રીજા આલીમનો વારો આવ્યો. મોહમ્મદ બીન ઈસા ઉઘાડા પગે અંધારી રાતમાં જંગલ તરફ

ચાલ્યા. આખી રાત ખુદાની મદદ માંગતા રહ્યા અને શિયાઓ આ અસાધારણ મોટી બલા ટળી જાય તે માટે દુઆઓમાં મશ્ગુલ રહ્યા. તેમણે ઈમામે ઝમાના (અ.) ને ફરીયાદો કરી અને મદદ માંગવી શરૂ કરી. રાત્રીના છેલ્લા પહોરમાં તેમની નજર એકાએક એક શખ્સ પર પડી. જેઓએ તેમને સંબોધીને કહ્યું : “અય માહમ્મદ બીન ઈસા શું થયું ? હું તમોને કેવી હાલતમાં જોઈ રહ્યો છું. આવા વેરાન જંગલમાં શા માટે આવ્યા છો ? તેમણે જવાબ આપ્યો. અય ભાઈ, તું મને મારી હાલત પર છોડી દે, હું મોટી મુશ્કેલીમાં ફસાયો છું. હું મારી આ મુશ્કેલીને મારા ઈમામ (અ.) સિવાય કોઈને પણ નહીં કહું. તે શખ્સે કહ્યું. અય મોહમ્મદ

બીન ઇસા હું જ ‘સાહેબુલ અમ્મ’ છું, તમારા દિલની વાત મને કહો તેણે કહ્યું ‘અય મારા આકા, જો આપ સાહેબુલ અમ્મ છો તો આપ જાણો છો કે હું કેટલી મોટી પરેશાનીમાં ઘેરાએલ છું. આપ અમારા ઇમામ છો અને અમને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવનારા છો. ઇમામ અ. મે ફરમાવ્યું, અય મોહંમદ બીન ઇસા વઝીરના ઘરમાં એક દાડમનું વૃક્ષ છે. વઝીરે દાડમના આકારનું માટીનું એક બીબુ (બ્લોક) બનાવેલ છે. જેના બે ભાગ છે. બન્ને ભાગોમાં તેણે એ અક્ષરો ઢાળેલા છે, જે બીબાને દાડમ સાથે લગાડી દીધા હતા. દાડમનું ફળ જરા મોટું થયું ત્યારે તે અક્ષર તેની ઉપર કોતરાઈ ગયા. કાલે તમે હાકીમ પાસે

જાવ ત્યારે કહેજો કે અમે જવાબ લાવ્યા છીએ. જે અમે વઝીરના ઘરે જઈને આપીશું. તમે વઝીરના ઘરે જાવ ત્યારે ઘરના જમણા ભાગમાં ઉપર એક ઓરડો છે. જ્યારે તે ઓરડામાં પહોંચો ત્યારે હાકીમને કહેજો કે તમારો જવાબ આ ઓરડામાં છે. વઝીર એવા પ્રયત્નો કરશે કે હાકીમ તે જુએ નહીં પણ તમે એ દેખાડવા માટે આગ્રહ કરજો. વઝીર ઉપર જાવ ત્યારે તમે પણ સાથ જજો અને તેઓને એકલા મુક્તા નહીં. તમે જેવા તે ઓરડામાં દાખલ થશા કે તુરતજ તમને દીવાલમાં એક બાકોડ દેખાશે. તેમા એક સફેદ થલી હશે. તેમાંજ દાડમના અક્ષર કોતરવા માટેના બીબા છે. જે કાઢીને હાકીમની સામે રાખી દેજો. ત્યાર પછી દાડમને

હાકીમ સામે રાખીને કહેજો કે અમે આપને એક બીજો મોઅજ્જલો પણ દેખાડીએ છીએ. આ દાડમની અંદર માટી અને કીડાઓ સિવાય બીજું કંઈ નથી. જો આપ આ હકીકત જાણવા માંગતા હો તો વઝીરને આ દાડમ ખોલવાનું કહો. વઝીર આ દાડમને તોડશે કે તરતજ તેનો ચહેરો માટી અને કીડાઓથી છવાઈ જશે.”

મોહમ્મદ બીન ઈસાએ ઈમામ અ.સ.ના પવિત્ર મુખેથી આ વાત સાંભળીને ખુબજ રાજી થતા થતા ઘરે પાછા ફર્યા. સવારે લોકોની સાથે હાકીમના દરબારમાં જઈ પહોંચ્યા અને ઈમામ અ.સ.ના સમજાવ્યા મુજબની બધી બાબત પર અમલ કર્યો. હાકીમ આ બધું જોઈ, સાંભળી ને આશ્ચર્યમાં ડુબી ગયો. અને તેણે

મોહમ્મદ બીન ઈસા ને પુણ્ય ક આ બધી માહિતી તમને કોણે આપી ? તેણે જવાબ આપ્યો કે, અમારા ઝમાનાના ઈમામે, જેઓ ખુદાની હુજજત છે. હાકીમે પુણ્ય : તમારા ઈમામ કોણ છે ? ત્યારે તેણે એક એક કરીને બધા નામોનો પરિચય કરાવ્યો. આ પછી હાકીમે મોહમ્મદ બીન ઈસાને કહ્યું કે તમારો હાથ લાવો, જેથી હું ગવાહી આપુ કે ખુદા સિવાય કોઈ અદ્દાહ નથી અને મોહમ્મદ સ.અ.વ. તેના બંદા અને પયગમ્બર છે. તેના પછી હ. અલી અ.સ. બિલા ફસ્લ ખલીફા છે. અને હું તમારા અઈમ્મા (અ.મુ.સ.) પર ઈમાન લાવુ છું. તે પછી હાકીમે વઝીરને કતલ કરી નાખવાનો હુકમ આપ્યો. પછી તેણે

બેહરૈનનાં લોકો (શિયાઓ) ની માફી માંગી
અને તેમની સાથ સદવ્યવહાર કરવા માંડયો.

આ બનાવનું વર્ણન કરનારા કહે છે કે આ
બનાવ બેહરૈનનાં નિવાસીઓ માં મશહુર છે.
અને મોહમ્મદ બીન ઈસાની કબ્ર પણ ત્યા
મૌજુદ છે. અને લોકો ત્યાં ઝીયારત માટે પણ
જાય છે. (નજમુસ્સાફીબ ૩૧૪ બેહાર
૧૭૮/૫૨)

કિસ્સો - ૯

ઈમામે વકત મોઅમીનોની

પનાહગાહ છે.

જનાબ શૈખ અબુ અબ્દેલ્લાહીલ હુસૈન
બીન અલહસન બીલ બાબવયા (ર.અ.) એ

પોતાના મોહતરમ કાકા જનાબ જઅફર મોહમ્મદ બીન અલી બીન બાબવયા (ર.અ.) થો નકલ કરે છે કે પવિત્ર શહેર કુમના મારા બુર્જુગ ઉસ્તાદો માંથો એક ઉસ્તાદે આ પ્રસંગને નકલ કર્યો છે કે :

મારા ઉપર એક એવી મુસીબત આવી પડી કે જેમા મને ખુબ દુઃખ પહોચ્યુ. અને હું પરેશાની (મુસીબત) થો કંટાળી ગયો મને તે યોગ્ય ન લાગ્યુ કે હું મારા કુટુંબી કે દોસ્તોને આ મુસોબતની વાત કરૂ.

એક વખત હું ગમગીન અને દુઃખમાં સુઈ ગયો. મે સ્વપ્નમાં જોયુ તો નુરાની બુર્જુગવાર કે જેઓ ખુબસુરત દેખાતા હતા અને ખુબસુરત પોશાક પહેર્યો હતો. તેમના શરીરમાંથો સરસ

ખુશ્બુ આવતી હતી. તેઓ મારી સામે ઉભા હતા. મે તેમને ઓળખી લીધા. તેઓ મારા ઉસ્તાદો માથો એક ઉસ્તાદ હતા, જેની પાસે મે કુમમાં શિક્ષણ લીધું હતું. મે મારા દિલને કહ્યું, કયા સુધી મારી મુસીબતને છુપાવીને રાખું. જનાબ તો મારા ઉસ્તાદ છે. હું મારી મુસીબત કહી દઉં, કદાચ રસ્તો મળી જાય. હું હજી તેમને વાત કરૂં તે પહેલાજ તેમણે વાત કરવાનું શરૂ કર્યું અને ફરમાવ્યું : જાઓ અને તમારા ઝમાનાના ઈમામ પાસે મદદ માંગો અને હીદાયત માંગો. તેમની પાસે રક્ષણ માંગો, કારણ કે તેઓ ઉત્તમ મદદગાર છે. અને મોઅમીનોની પનાહગાહ છે. તે પછી તેમણે પવિત્ર જમણો હાથ હથળી પર ફેરવીને

કહ્યુ “ જાઓ અને તેમની ઝીયારત પઢા”
તેની પર સલામ મોકલો, હું પણ ઇમામ
અ.સ.ને ભલામણ કરીશ. કે તેઓ તમારા
હુકમ દુનિયાઓના પાલનહાર પાસે શક્ષાત
અને ભલામણ કરે.

મે કહ્યુ, આપ મને બતાવો કે હું કેવી
ઝીયારત અને સલામ પઢુ ? અને કેવી રીતે
દુઆ માંગો ? કારણ કે આ મુસીબત માં હું
બધીજ ઝીયારત અને દુઆ ભુલીગયો છુ આ
સાંભળીને તેમણે એક લાંબો સ્વાસ લીધો
અને કહ્યુ ‘લાહલ્લ પલા કુવ્વત ઇલા બીલાહ’
અને મારી છાતી ઉપર હાથ રાખી દીધો, કહેવા
લાગ્યા કે અલાહ તમારા માટે પુરતો છે. હવે
તમારા ઉપર કોઈ મુસીબત નહી આવે. જાવ,

ગુસ્લ કરો અને બે રકાત નમાઝ પઢો. આસમાનની નીચે અને કીબ્લા તરફ મોઢુ રાખીને ઝીયારત સલામુઘાહીલ કામેલુતામ પઢો. જ્યારે દુઆ અને ઝીયારત પુરી થઈ જાય પછી જે ચાહો તે માંગો.

આ સાંભળતાજ મારી આંખ ખુઘી ગઈ કે મારી મુશ્કેલીનો અંત હાથ વેતમાં છે. હવે મને રાત ઘણી લાંબી લાગવા લાગી. જે કાંઈ મને સ્વપ્નની હાલતમાં શિખવવામાં આવ્યુ હતું. તે હું ભુલી જાય તે પહેલા મેં લખી લીધુ. ત્યાર પછી ગુસ્લ કર્યુ. આસ્માનની નીચે બે રકાત નમાઝ પઢ્યો. પહેલી રકાતમાં સુરે હમ્દ પછી સુરે ફત્હ પઢ્યો, જેવીરીતે કે તે આખો સુરો મારી નજર સામે છે. બીજી રકાતના હમ્દના

સુરા પછી એઝાજઅ નસ્તુદાહ પડ્યો. નમાઝ પુરી કરીને પછી કીબ્લા રૂખ થઈને આ ઝીયારત પડ્યો. અને અંતમાં મારી હાજતો માંગી, અને મારા મોલા અને આકા (ઈમામ સાહેબુઝ ઝમાન અ.ત.ફ.શ.) પાસે પનાહ યાહી. પછી શુકનો સજદો બજાવી લાવ્યો અને એજ હાલતમાં મારી દુઆઓને એ સમય સુધી લંબાવી કે મને એ ડર લાગ્યો કે નમાઝે શબ કઝા થઈ જશે. નમાઝે શબ અને તેની તઅકીબાતો પુરી કર્યા પછી નમાઝે સુબ્હ પડ્યો. પછી મહેરાબમાં બેસીને દુઆ માંગતો હતો. ખુદાની કસમ ! હજુ સુરજ નિકળ્યો પણ ન હતો કે મારી મુસીબત દુર થઈ ગઈ. અને પુરી જીંદગીમાં ક્યારેય આ પ્રકારની

મુસીબતોમાં હું ફરી ફસાયો નથો. અને મેં આજ સુધી કોઈને આ મુસીબતના બારામાં જણાવ્યું નથો. તમામ રહેમતો અને હમ્દો સનાઅ મહાન પરપરદિગાર માટે છે.

નોંધ : ગુસ્લ કરવું, આસમાનની નીચે ઉભા રહેવું, બે રકાત નમાઝ પઢવી, આ બધું અફઝલ છે, પરંતુ કોઈ વ્યક્તિ કોઈ કારણ ને લીધે આ રીતે ન કરી શકે તો પણ ઝીયારતને છોડી દેવી જોઈએ નહીં. જો તે માત્ર ઝીયારત પડે તો પણ સવાબનો હકદાર થશે. ઝીયારતે ઈસ્તેગાસા મફ્તીહુલ જીનાન તથા દુઆએ નુદબાહની કિતાબનાં પાછળનો પેજ ઉપર છે. (બેહાર, મફ્તીહુલ જીનાન)

કિસ્સો - ૧૦

મુકદ્દસે અર્દબેલી (અ.ર.) ને ઈમામની મુલાકાત

આ પ્રસંગ અઘામા અમીર અઘામ વર્ણવે છે. તેઓ જલીલુલકદ્ર આલીમ, મુજતહીદ જ. મુકદ્દસે અર્દબેલી (અ.ર.) નાં વિદ્યાર્થી હતા. તેઓ બયાન કરે છે કે એક વખત રાત્રે હું મારું કામ પુર્ણ કરી અમીરૂલ મોઅમેનીન અ.સ. નાં રોઝાનાં સહેનમાં બહાર નિકળ્યો. રાત અડધી પસાર થઈ ગઈ હતી. મેં જોયું કે એક આલીમ, અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. ના રોઝા તરફ જઈ રહ્યા છે. હું તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. મે તેમને ઓળખી લીધા. તેઓ મારા ઉસ્તાદ

મુકદ્દસે અર્દબલી (અ.ર.) હતા. મે મારી જાતને તેમનાથો છુપાવી રાખી. તેઓ રોઝાના દરવાજા પાસે પહોંચ્યા. દરવાજા પર તાળુ મારેલુ હતુ. તેમના પહોંચતાજ તાળુ ચાવી વગર ખુલી ગયુ. અને નીચે પડી ગયુ. અને રોઝાના દરવાજા ખુલ્લી ગયા. મારા ઉસ્તાદ રોઝામાં દાખલ થયા. પછી મે વાતચીત થતી હોય તેવો આવાઝ સાંભળ્યો જાણે કે તેઓ કોઈની સાથ વાતચીત કરી રહ્યા છે. થોડીવાર પછી તેઓ બહાર નીકળ્યા. રોઝાનો દરવાજો આપમેળે બંધ થઈ ગયો. તેઓ નજફ્થો મસ્જીદે કુફા તરફના રસ્તે ચાલવા લાગ્યા. હું પણ તેમની પાછળ પાછળ ગયો. તેઓ મસ્જીદે કુફામાં દાખલ થયા. અને મહેરાબમાં

કે જ્યાં મોલાએ કાએનાતને ઝરબત લાગી હતી અને આપની શહાદત થઈ હતી. તે જગ્યાએ પહોંચ્યા. ત્યા તેઓ ઘણો સમય સુધી રોકાયા. પછી આપ નજફ તરફ પાછા વળ્યા. હું તેમની પાછળ હતો. તેઓ જ્યારે મસ્જિદે જુનાત પાસે પહોંચ્યા, ત્યારે અયાનક મને ઉઘરસ આવી, જને હું રોકી ન શક્યો. મારા ઉસ્તાદ મને ઓળખી ગયા અને કહ્યુ કે અમીર અદામ તમે અહીં શું કરો છો ? મે કહ્યુ કે હું તમારી સાથ રોઝાથો છું. હું આપને અમીરૂલ મોઅમેનીન અ.સ. નાં હકકની કસમ આપુ છુ કે જે કાંઈ બનાવ બન્યો તે મને બતાવો. તેઓએ કહ્યુ કે હું તને આ બધી વાત કડ પાણ મારી એક શર્ત છે, કે જ્યા સુધી હું

હયાત રહું ત્યા સુધી તુ કોઈને આ વાતની જાણ નહિંકરે. મે આ શર્ત સ્વીકારી તેઓએ ફરમાવ્યુ, કે મારે કેટલાક મસાએલ હતા, જેના બારામાં મને ચિંતા હતી. તેના જવાબો મને મળતા ન હતા. મે ચાહ્યુ કે હું રાઝએ મુકદ્દસમાં જાવ અને જવાબ મેળવું. તેથી હું આ રોઝામાં ગયો. જેમ તે જોયુ તેમ રોઝાના તમામ દરવાજાનાં તાળા ચાવી વગર ખુદી ગયા અને દરવાજા પોતાની મેળે ખુદી ગયા. હું મોલાએ કાએનાતના રોઝામાં દાખલ થયો. અને મસાએલના જવાબ માટે દુઆ કરી. હું દુઆમા મશગુલ હતો ત્યારે કબ્રે અલી અ.સ. થો અવાઝ આવી. “મોલાના અહેમદ મસ્જીદે ફુફા ચાલ્યા જાવ, અને તમારા મસઅલાના

જવાબ કાએમે આલે મોહમ્મદ (ઈ. મહદી અ.) થો પુછો. અને તેઓ તમને આ મસઅલાના જવાબ આપશે, કારણ કે તેઓ આ ઝમાનાના ઈમામ છે. તમામા કાર્યોની મસ્લેહત અને મુનાસેબત તેમનાથો સંબધીત છે.” આ સાંભળીને હું મસ્જીદે કુફા પહોંચી ગયો. ત્યા મે ઈ. આખેરૂઝઝમાન ની ખિદમતથો મારા સવાલોના જવાબ મેળવ્યા, અને હવે હું ઘર તરફ રવાના થાઉ છું. (ઈરફાને ઈમામત કિસ્સો - ૮)

કિસ્સો - ૧૧

શૈખ મુર્તઝા અન્સારી (અ.ર.) ને ઈમામ અ.સ. ની મુલાકાત

આયતુલાહ ઉઝમા હાજી શૈખ મોહમ્મદ હસન સાહેબ જવાહર (ર.અ.) ની વફાત પછી લોકોએ શૈખ મુર્તઝા અન્સારી અ.ર. ને મરજએ તકલીદ નકકી કર્યા અને તેમના અમલીયાનો રીસાલો, તવઝીહુલ મસાએલ માંગી. શૈખ અન્સારીએ ફરમાવ્યુ : સૈયદુલ ઓલમાં માઝન્દરાનીની હાજરી માં મારી પાસે તવઝીહુલ મસાએલ નથો. તે મારાથો “આઅલમ” (વધુ જ્ઞાની) છે અને બાબીલમાં રહે છે. હું મરજીઅત સ્વીકારીશ નહીં.

શૈખ અનસારીએ સૈયદુલ ઓલમાને બાબીલ એક પત્ર લખ્યો તેમા વિનંતી કરી કે આપ નજફે અશરફ તશરીફ લાવો અને શીયાઓના હવઝે ઈલ્મીયાની આગેવાની સ્વોકારો. સૈયદુલ ઓલમાએ શૈખ અનસારીના પત્રનો જવાબ આપ્યો કે એ સાચુ છે કે જ્યારે હું નજફે અશરફમાં હતો ત્યારે આપની સાથ મુબાહેસા (ચર્ચા) કરતો હતો, ફીકહમાં આપથો વધુ જ્ઞાન ધરાવતો હતો, પરંતુ હવે લાંબા સમયથી બાબીલમાં રહું છું. દર્સ અને દર્સ આપવાનો સોલસીલો નથી રહ્યો. ચર્ચાઓની બેઠકો છોડી ચુક્યો છું. આ કારણ થી હવે હું ખુદ આપને આઅલમ ગણુ છું. તેથી મરજેઅત આપ ખુદ કબુલ ફરમાવો.

શૈખ અનસારીએ તેમ છતા કહ્યુ કે હું ખુદ પોતાને આ સ્થાન અને મન્સબને લાયક નથી ગણતો. જો મારા મોલા અને આકા હ. વલીઅ અસ્ર (અજ.) મને ઈજતેહાદની પરવાનગી ઈનાયત ફરમાવે અને મારી આ સ્થાન અને મનસબ માટે નિમણુંક કરે તો હું સ્વીકાર કરીશ.

એક દિવસ શૈખ અનસારી શિક્ષણ આપવા બેઠા હતા. અને તેમના વિદ્યાર્થીઓ પણ તેમની આજુબાજુ બેઠા હતા. એક વ્યક્તિ દાખલ થયા. તેમની મહાનતા અને દિવ્યતાની અસરો જોવા મળી શૈખ અનસારીએ તેમને આદર પૂર્વક આવકાર આપ્યો. તે શખ્સે

વિદ્યાર્થીઓની હાજરીમાં શૈખ અન્સારી તરફ જોઈને પુછ્યુ :

એક સ્ત્રી કે જેનો પતિ મસ્જિ (મનુષ્ય સ્વરૂપ બદલાવુ) થઈ ગયો હોય તેના બારામાં આપનો શું મત છે ? (આ મસઅલો કોઈ કિતાબમાં પણ દર્શાવવામાં આવ્યો નથી. કારણ કે આ ઉમ્મતમાં મસ્જિનું અસ્તિત્વ નથી.)

આ વાત ઉપર શૈખ અન્સારીએ કહ્યુ ફીકહની કિતાબોમાં આ મસઅલો લખવામાંજ નથી આવ્યો. તેથી હું જવાબ દેવા માટે સમર્થ નથી. તે શખ્સે પુછ્યુ : હવે આપ ધારી લ્યો કે આ ઉમ્મતમાં એક એવો પ્રસંગ પ્રકાશમાં આવ્યો છે કે એક સ્ત્રીનો પતિ મસ્જિ થઈ ગયો

છે તો તે સ્ત્રી શું કરે ? શેખ અન્સારીએ કહ્યુ મારા મત (ફતવા) મુજબ જો પુરૂષ પ્રાણીના સ્વરૂપમાં બદલાયો છે, તો સ્ત્રી માટે જરૂરી છે કે તે તલાકનો ઈદદો પાળે અને એ મુદ્દત પછી નિકાહ કરી શકે છે કેમકે તે પુરૂષ જીવીત છે અને તેને રૂહ પણ છે. પરંતુ જો તે પુરૂષ વનસ્પતિના સ્વરૂપમાં બદલાયો છે તો તેની પત્ની મૃત્યુનો ઈદદો પસાર કરે કારણ કે તેના પતિએ મુદાનું સ્વરૂપ ઈખ્તેયાર કર્યુ છે. એટલે એ મુદ્દત પછી નિકાહ કરી શકે છે.

તે શખ્સે ત્રણ વખત કહ્યુ : અન્તલ મુજતહેદો, અન્તલ મુજતહેદો, અન્તલ મુજતહેદો એટલે કે “તમે મુજતહેદ છો.”

ત્યાર પછી તે શખ્સ શિક્ષણની બેઠકમાંથી બહાર ચાલ્યા ગયા. શૈખ અન્સારી જાણતા હતા કે તે હ. ઈમામે વલીએ અસ્ર (અજ.) હતા. અને તેમણે ઈજતેહાદની પરવાનગી આપી છે. તેથી તુરંતજ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે તે શખ્સની તપાસ કરો. વિદ્યાર્થીઓ તરતજ ઉભા થયા. અહીં તહીં દોડતા રહ્યા પરંતુ કોઈએ પણ તેમને ન જોયા. તે પછી શૈખ અન્સારી એ વાત ઉપર તૈયાર થયા કે લોકોને તવઝીહુલ મસાએલ રજુ કરે, જેથી લોકો તેમની તકલીદ કરે.
(“ગન્જનીએ દાનીશમન્દાન” ભાગ - ૮)

કિસ્સો - ૧૨

ઝવ્વારે ઇમામ અ.સ. ને પરેશાન કરનાર ખાદીમનો અંજામ

જત્રતુલ મઆવા કિતાબના લેખક કહે છે કે મને ભરોસાપાત્ર અને અમીન આગા મોહમ્મદ કાઝમૈનીએ આ પ્રસંગ બયાન કર્યો છે.

આગા મોહમ્મદ કાઝમૈની બયાન કરે છે કે એક શખ્સ જેનું નામ મુસ્તફા જમુદ હતુ અને તે રોઝા મુબારકનો ખાદીમ હતો. તેની આદત એ હતી કે તે ઝવ્વારો ને લુટતો અને ઝવ્વારોને ખુબ ઈજા પહોંચાડતો અને ઘણી વખત સરદાબે મુકદ્દસ ની અંદર ઝવ્વારોને ખુબ પરેશાન કરતો હતો. તે માણસ આમાલે

ઝીયારતમાં રુકાવટ કરતો અને એવી હરકતો કરતો કે ઝવ્વારોની તવજ્જોહમાં ખલીલ પહોંચતી. ઝવ્વારોની દુઆઓનું પઢવું તેને ન ગમતું અને તે તેઓની આવાઝ ન સાંભળતો.

એક રાત્રે આ ખાદીમે ઇમામે હુજ્જત (ઇમામે ઝમાના) અ.સ. ને સ્વપ્નમાં જોયા. ઇમામે ઝમાના અ.સ. કહી રહ્યા હતા કે ક્યાં સુધી તું મારા ઝવ્વારોને પરેશાન કરતો રહીશ ? તું તેઓને ઝીયારત પઢવા નથો દેતો. તને શું મતલબ છે જે કાંઈ તેઓ કહે છે, પઢે છે, તુ તેઓને કરવા દે. ત્યાર પછી જ્યારે તે માણસ સ્વપનમાંથી જાગ્યો ત્યારે તેની સાંભળવાની શક્તિ ચાલી ગઈ હતી. તેના કાન ફાટી ગયા હતા. તે કાંઈ પણ સાંભળી નહોતો શકતો.

જેનાથો ઝવ્વારોને રાહત મળી ગઈ, અને આમાલે ઝીચારતની અદાએગી, દુઆ, ફરીયાદ અને ઇસ્તેગાસામાં આ શખ્સની રૂકાવટ ન રહી એટલે સુધી કે ખુદાવંદે આલમે તેને ઠેકાણે લગાડી દીધો. (ઇરફાને ઇમામત, કિસ્સો - ૫૨)

કિસ્સો - ૧૩

આંખથી થતા ગુનાહથી બચવાને કારણે

ઇમામ અ.સ. થી મુલાકાત

એક મઝદુર માણસ એક આલીમ પાસે ગયો અને કહ્યું કે હું આટલા દિવસ પછી આ દિવસે અને આ સમયે મૃત્યુ પામીશ. તમે મને ગુસ્લ, કફન આપજો. અને મારી નમાઝે મર્યત પઢાવજો તે આલીમે સંમતી આપી.

પછી જે દિવસનું તે માણસે કહ્યું હતું તે દિવસે તે આલિમે દીન તેના ઘરે જવા માટે નીકળ્યા રસ્તામાં આલીમે દીનને વિચાર આવ્યો કે આ માણસ ને ખબર કેમ પડી કે આ દિવસે અને આ સમયે તેને મૌત આવશે ? આલીમે દીન તે મજદુર માણસના ઘરે પહોંચ્યા હજુ દરવાજા સુધી પહોંચ્યા ત્યારે તેઓ એક નુર ને જોયું. આ નુર તે મજદુર માણસના ઘરમાં દાખલ થયું તે આલિમે દીન આ નુરના પ્રભાવથી ત્યાજ ઉભા રહી ગયા. અને ઘરમાં દાખલ ન થયા. થોડીવાર પછી તે નુર ઘરની બહાર નિકળી જાય છે. પછી તે આલીમે દીન ઘરમાં દાખલ થયા. અને પહેલો સવાલ તે મજદુર ને એ કર્યો કે તમને ખબર કેમ પડી કે આ દિવસે અને આ

સમયે તમારૂં મૌત છે ? અને તમારા ઘરમાં જે નુર દાખલ થયુ તેની હકીકત શું છે ?

તે મઝદુર માણસ કહે છે કે આની પાછળ એક લાંબી દાસ્તાન છે. હું એક સામાન્ય ગુનેહગાર માણસ હતો. મેં મજલીસમાં સાંભળ્યુ હતુ કે આપણા વક્તના ઈમામ મૌજુદ છે જીવંત છે. તો પછી મેં વિચાર્યુ કે ઈમામ અ.સ. ની મુલાકાત શા માટે નથી થતી. ? ત્યારે મેં વિચાર્યુ આમા વાંક મારો છે. મારા એ ગુનાહ છે જે મારી અને ઈમામ અ.સ.ની વચ્ચે પરદો બની ગયા છે. મારી આ આંખ જે ગુનાહો કરતી હોય તે નજીસ આંખથી માઅસુમ ઈમામ અ.સ.ની ઝીયારત કેવી રીતે થાય. ત્યારથી મેં આંખથી થતા ગુનાહ છોડી

દેવાનો મક્કમ નિર્ણય કર્યો અને આ વાત ઉપર અમલ શરૂ કર્યો. મે આંખથી થતા ગુનાહો છોડી દીધા. ઈમામે ઝમાના અ.સ.ને આ કાર્ય એટલુ પસંદ આવ્યુ કે તેઓ મને મસ્લેહતન ઘણીવાર મુલાકાત આપતા. છેલ્લે મને ઈમામ અ.સ.એ મારા મૃત્યુના બારામાં ખબર આપી હતી.અને તમારી ભલામણ કરી કે તમે મને ગુસ્લો -કફન આપો. અને હમણાં તમે જે નુર જોયું હતુ. તે ઈમામે ઝમાના અ.સ. નું નુર હતુ અને તેઓ મને મળવા આવ્યા હતા. અને તમને સલામ આપ્યા છે. (જન્નતુલ મઆવા)

કિસ્સો - ૧૪

ઇમામ અ.સ.ની સલામતી માટે સદકો
કાઢ્યો.

ઇમામે ઝમાના અ.સ. આપણા સદકાના મોહતાજ નથી પરંતુ ઇમામે ઝમાના અ.સ. માટે સદકો કાઢવો તે આપણી ઇમામ તરફની મોહબ્બત નો ઇઝહાર છે. સદકો પણ તે ઇમામની તવજજોહ અને નઝદીકીનું કારણ બને છે.

એક તાલીબે ઇલ્મ કહે છે કે એક રાત્રે મશહદે મુકદ્દસમાં ઇમામ રેઝા અ.સ. ના મુબારક રોઝાની અંદર મે ઇમામે ઝમાના અ.સ. માટે ખુબ દુઆ કરી મોડી રાતે હું મારી હોસ્ટેલ તરફ જવા લાગ્યો રસ્તામાં એક ફકીર

મબ્યો જેણે મને સવાલ કર્યો. મે મામુલી રકમનો સદકો ઈમામે ઝમાના અ.સ.ની મોહબ્બતમાં સલામતી માટે આપ્યો. બીજે દિવસે હું તેજ બજારમાં નીકળ્યો. એક દુકાનદારે ઉચા અવાજે મને બોલાવ્યો અને પુછ્યુ કે ગઈ કાલે તે શું નેક કામ કર્યુ હતુ ? મે પુછ્યુ વાત શુ છે ? તમે મને આવુ શા માટે પુછો છો ? દુકાન દાર કહ્યુ, ગઈ કાલે હ. બકીચ્યતુદ્દાહ અરવાહુના લહુલ ફીદા ને મે સ્વપ્નમાં જોયા. તેઓ સફેદ રંગના ઘોડા પર આ જગ્યાએ આ બજારમાં તશરીફ લાવ્યા અને તારૂ નામ લઈ ને કહ્યુ કે હું તે તાલીબે ઈલ્મના અહેસાનનો બદલો ચુકવવા આવ્યો છું. તે શું અહેસાન કર્યો હતો ? તાલીબે ઈલ્મ

ઝારોકતાર રડવા લાગે છે. અને કહે છે કે મે તો ઇમામ અ.સ. ની મોહબ્બતમાં મામુલી રકમનો સદકો આપ્યો હતો.

(ઇમામે ઝમાન અ.સ. અને સૈયદ ઇબ્ને તાઉસ અ.ર. પેજ-૧૦૭, ૧૦૮)

કિસ્સો - ૧૫

અબુ મોહમ્મદ અંધ થઈ ગયા

નજમુસ્સાકીબના લેખક આ રીવાયતને કુતબે રાવંદી અ.ર. ની કિતાબ ખ્વારીઝમાંથી લખે છે કે અબુ મોહમ્મદ અલઝી ના બે દીકરા હતા એક અબુલ હસન જે પરહેઝગાર અને નેક દીકરો હતો, તે મચ્ચતને ગુસ્લ આપવાના કાર્યમાં પણ મદદરૂપ થતો. જ્યારે બીજો દીકરો ગુનાહખોરીમાં મશગુલ રહેતો.

એક વખત એક મર્દે મોઅમીને અબુ મોહમ્મદને ઈમામે ઝમાના અ.સ. ની નિયાબતમાં હજ કરવા માટે અમુક રકમ આપી. અબુ મોહમ્મદે આ રકમમાંથી અમુક રકમ તેના ગુનેહગાર ટીકરાને આપી અને હજ અદા કરવા માટે પોતાની સાથ લઈ ગયા. અબુ મોહમ્મદ પોતે આ વાત કહે છે કે મે મેદાને અરાફાતમાં એક ખુબસુરત નવજુવાનને જોયા, જેઓ દુઆ પઢવામાં મશ્ગુલ હતા. જ્યારે હું તેમની નજદીક પહોંચ્યો તો તેઓ મારા તરફ મુતવજજેહ થયા અને ફરમાવ્યુ કે એ શોખ તને શર્મ નથી આવતી ? મેં પુછ્યુ કઈ વાત થી ? ઈમામે ઝમાના અ.સ. મે ફરમાવ્યુ હજ કરવાનું તને સોપવામાં આવ્યુ હતુ અને તે

એક ગુનેહગાર અને શરાબખોરને હવાલે (હજ કરવાનું) સોંપી દીધું. નજદીકમાંજ તુ આ આંખથી આંધળો થઈ જઈશ. ત્યાર પછી પાછા આવ્યા પછી ૪૦ દિવસ પણ પસાર ન થયા હતા કે એ આંખ કે જેની તરફ ઈમામ અ.સ. મે ઈશારો કર્યો હતો, તે આંખમાં એવું ઝખ્મ થયું કે તેની આંખ ચાલી ગઈ. અને તે એક આંખથી અંધ થઈ ગયો. (ઈસ્કાને ઈમામત કિસ્સો - ૫૦)

કિસ્સો - ૧૬

**ઈબ્રાહીમ ઈબ્ને મહઝીયાર ને ઈમામ
અ.સ. ની મુલાકાત**

હ. મહદી અ.સ. નાં એક આશીકનો પ્રસંગ છે. જેનું નામ ઈબ્રાહીમ ઈબ્ને મહઝીયાર

હતુ. જે મહદી એ ઝહેરાની દીદારની ઉત્સુકતામાં દુનિયાની બધીવાતોને ભુલીગયો હતો. એ પ્રસંગ અત્રે તે આશીકે ઈમામ અ.સ. ના પોતાના શબ્દોમાંજ પ્રસ્તુત છે.

“એક વરસ મે હ. ઈમામ હસન અસકરી અ.સ. ની અવલાદ ઈમામે ઝમાના અ.સ. વિષે ખાતરી કરવા મદીનાનો પ્રવાસ ખેડયો. પરંતુ મને કહી જાણવા ન મળ્યુ ત્યાથો મકકા ગયો ત્યા પણ મારા ઈમામ વિષે કંઈ જાણવા ન મળ્યુ. એક દિવસ હું ખાનએ કાબાનો તવાફ કરી રહ્યો હતો ત્યારે એક ખુબસુરત યુવાનનું મારી તરફ ધ્યાન ખેચાયુ જે મને ખુબજ ટીકીટીકીને જોઈ રહ્યો હતો. તે યુવાન મને કંઈક મદદરૂપ થશે તેમ માનીને હું તેમની તરફ

ગયો. તેને સલામ કરી તેણે મારી સલામ નો જવાબ ખુબજ સારી રીતે આપ્યો પછી તેણે મને પુછ્યુ તમે કયાના રહેવાસી છો ? મે કહ્યુ અહઝવાઝનો. આ રીતે વાતચીત શરૂ થઈ ત્યાર પછી તે યુવાને કહ્યુ કે “હું તમારા માટે એક ખબર પણ લાવ્યો છું જે તમે તમારા ઈમામ અ.સ. ની ઝીયારત સાથ એ ઈચ્છતા હો કે તમારી આંખો એ હઝરતના નુરાની પ્રકાશનો ઝગમગાટ જુએ તો મારી સાથ તાએફ સુધી ચાલો પરંતુ મારી સાથ આવવાની તમારી સફરને તમારા મિત્રોથી ખાનગી રાખજો” હું તેમની સાથ તાએફ તરફ જવા રવાના થયો. જ્યારે અમે એક મોટા રણમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દુરથી

એક તંબુ નજરે પડ્યો. જેના નુરથો આખુ રણ ઝળહળી રહ્યુ હતુ.

તે ચુવાન તંબુમાં મને અંદર જવા માટેની પરવાનગી મેળવવા ગયો. એટલામાં મે જોયુ કે તે તંબુમાંથી અજોડ પ્રભાવશાળી અને નુરાની બુઝુર્ગવાર બહાર પધાર્યા. તેમની ખુબસુરતી અવર્ણનીય હતી. હું ખુબજ આવેશ અને અર્ધ પાગલપણાની હાલતમાં તેમની તરફ દોડ્યો અને તેમના હાથપગ ચુમવા લાગ્યો. તે બુઝુર્ગે ફરમાવ્યુ “તારુ આગમન મુબારક થાય આ સમય પહેલા તારી મુલાકાતનું વચન આપવામાં આવ્યુ હતુ. તારી અને મારી વચ્ચે રૂહાની સંબધ સ્થાપીત છે. આપણા બન્નેની વચ્ચે રસ્તાનું લાંબુ અંતર અને આપણી

મુલાકાતમાં વિલંબ છતાં મેં હંમેશા જ તને મારી નજરો સમક્ષ રાખેલ છે” ત્યાર પછી આપે એક લાંબી વાતચીત કરતા કહ્યું, મારા પિતાજીએ મને કહ્યું હતું એ ફરઝંદ જે લોકો ખુદાની ઈબાદત કરે છે અને તેની પેરવી અને તાબેદારી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. અઘ્લાહ ત.ત. તેને બંદાઓ માટે નમુનારૂપ બની રહે એ માટે માર્ગદર્શક વગરનો રાખતો નથી”

ઈબ્રાહીમ બીન મહેઝીયાર નું કહેવું છે કે એક સમયગાળા સુધી હું ઈમામ મહદી અ.સ.ની ખીદમતમાં રહ્યો. તેજસ્વી સત્યો, ગુરાની હુકમો અને કેટલીય ઈત્મ અને હીકમતનો વાતો શિખ્યો જે બાબતો ખુદાએ

તઆલાએ આપની છાતીમાં ઉંડાણથી ભરી
હતી. તેનો ખુબજ ફાયદો મેળવતો રહ્યો....
અને આહ ! પછી જવા માટે પરવાનગી
માંગી. છેવટે જ્યારે છુટા પડવાની તૈયારી કરી
ત્યારે હઝરત અ.સ. ની ખીદમતમાં પહોંચ્યો.
આપની સાથ વફાદારીના વચનને દોહરાવીને
જવાની તૈયારીમાં હતો ત્યારે આપે ફરમાવ્યુ
“ખુદાવંદે અઝઝવજહે જે વસ્તુને તારા માટે
આસાન અને બરકત પુર્ણ કરી. તને સાલેહ
લોકોના શ્રેષ્ઠ સવાબ અને પોતાના ખાસ
બંદાઓની જઝા આપી. બધી વસ્તુઓ
તેનાથી જ છે અને જે કાંઈ જોઈતુ હોય તે તજ
આપી શકે તેમ છે. ખુદાવંદે આલમ તને તેની
અપાર નેઅમતો સલામતી અને ખુશહાલી

સાથ તારા મિત્રો સુધી પહોંચાડે, તને રસ્તામાં કોઈ તકલીફ ન પડે... હું તને ખુદાને હવાલે કરૂ છું ઇ.અ. ખુદાવંદાની કૃપાળુ છાયામાં તને કોઈ આફત નહીં આવે”.

ઈબ્રાહીમ બીન મહઝીયાર કહે છે કે હું હ. મહદી અ.ત.ફ.શ. પાસેથી વિદાય થયો. હું ખુદાવંદે ત.ત. નો બેહદ શુક્રગુઝાર છું. કે તેણે મારા સાચા હેતુ સુધી પહોંચવામાં મારી મદદ કરી અને સાથો સાથ એ વાતથી પણ વાકેફ થઈ ગયો કે ખુદાવંદે આલમ પોતાની ઝમીનને કોઈપણ સમયે માઅસુમ ઈમામ અ.સ. વગર ખાલી નથી રાખતો. મે આ પ્રસંગ ચકીન અને ઈમાન ધરાવતા લોકોની જાણકારીમાં વિશેષ

વધારો થાય તે હેતુસર રજુ કરેલ છે.(ઈરફાને
ઈમામત કીસ્સો - ૧)

કિસ્સો - ૧૭

પતિ-પત્નીના મતભેદનું સમાધાન

આ તવકીઅની વાત કરીએ તે પહેલા તેના અમલીકરણના પાસાઆ ઉપરની ચર્ચા બહેતર છે. પયગમ્બર અકરમ (સ.) અને અઈમ્મએ હોદા (અલયહેમુસ્સલામ) ઉમ્મતના વાલીઓ છે. આ બાબત વિષે આ લેખમાં ઉપર લખાઈ ચુક્યું છે કે ખુદા વંદે આલમે તેઓની ભવ્યતા અને મહાનતા ખાતર તેઓને ઘણી શક્તિઓ અર્પણ કરી છે. આ હઝરતો રોજી આપવાની શક્તિ ધરાવે છે. એટલે કે તેઓ જે વસ્તુની ખુદા પાસે માંગણી

કરે છે તે નકારતો નથી. આ તવકીઅમાં આ વાત ઉપર ઈશારો કરવામાં આવ્યો છે.

અબુ ગાલીબ અહમદ બીન મોહમ્મદ ઝોરારી કહે છે : મારી અને મારી પત્નિ વચ્ચે મોટા મતભેદો અને દુશ્મની થઈ ગઈ. અમારી વચ્ચે સમાધાનની બધી શક્યતાઓ પૂરી થઈ ગઈ. આ મતભેદ લાંબો ચાલ્યો. તેના કારણે હું ઘણી માનસિક તાણ અનુભવતો હતો. તેથી મેં એક પત્ર જનાબ મોહમ્મદ બીન ઉસ્માન (ર.અ.) (બીજા નાએબ) ને આપ્યો કે તે તેને ઈમામે ઝમાના (અ.) ની સેવામાં પહોંચાડી આપે. આ પત્રમાં મેં દોઆ માટે દરખાસ્ત કરી હતી. પત્રના જવાબમાં ઘણું મોડું થયું. એક વખત અબુ જઅફર (મોહમ્મદ બીન ઉસ્માન

(અ.ર.) સાથ મુલાકાત થઈ ત્યારે આપે કહ્યું : તમારા પત્રનો જવાબ આવી ચુક્યો છે. પછી તેમના ઘરે ગયો. એક ચોપડો કાઢ્યો અને તેના પાનાઓ ત્યા સુધી ફેરવ્યા કે એક પત્ર મળ્યો અને મને દેખાડ્યો. જેમા લખેલું હતું : પતિ અને પત્નિ અંગેનો જે પ્રશ્ન પૂછ્યો હતો તો ખુદાવંદે આલમે તેઓની વચ્ચે સુલેહ અને શાંતિ સ્થાપિત કરી દીધી છે.

અબુ ગાલીબ ઝોરારી કહે છે કે મારી પત્નિ હંમેશા કડકાઈથી વર્તન કરતી હતી. પરંતુ આ પ્રસંગ પછી ભૂતકાળના મતભેદોની જેમ કોઈ પ્રસંગ બન્યો નહીં. બલકે હું ક્યારેક જાણીબુજીને એવું કામ કરતો કે તેને ગુસ્સે કરું, તો પણ તેની તરફથી કોઈ પ્રતિભાવ

જણાતો ન હતો. (પઝે વહશીએ પીરામુને ઝીન્દગાનીએ નુવ્વાબે ખાસે ઈમામે ઝમાના (અ.) (ઈમામે ઝમાના (અ.) ના ખાસ નવ્વાબોના જીવન પાના ૧૭૬)

કિસ્સો - ૧૮

શેખ મુફીદ અ.ર. ને ઈમામ અ.નો પત્ર

મર્દુમ તન્કાબની ફરમાવે છે : એક દિવસ બગદાદના કસ્બામાંથી એક માણસ શેખ મુફીદ અ.ર. ની પાસે શરીઅતનો મસઅલો પૂછવા માટે આવ્યો. તેણે કહ્યું “સાહેબ એક ગર્ભવતી સ્ત્રી મૃત્યુ પામી છે, પરંતુ પેટમાં તેનું બાળક જીવતું અને સલામત છે. આપ શું ફરમાવો છો ? ઓપરેશનથી બાળકને કાઢી

લેવામાં આવે કે સ્ત્રીને તેના બાળક સાથે દફન કરી દેવામાં આવે. ?

શૈખ મુફીદ અ.ર. મે ફરમાવ્યુ : માને તેના પેટમાં મૌજુદ બાળકની સાથે દફન કરી દેવામાં આવે

તે માણસ પોતાના ગામ જવાના રસ્તે પાછો ફરી રહ્યો હતો, તેવામાં તેની સામે એક ઘોડે સવાર આવ્યા તેમણે કહ્યુ ઉભા રહો. તે પછી કહ્યુ શૈખ મુફીદ અ.ર. એ કહ્યુ છે કે માના પેટમાંથી બાળક ઓપરેશન કરીને બહાર કાઢીલેવું. પછી માંના પેટને સીવીને એકલી સ્ત્રીને દફન કરવામાં આવે.

તે માણસે આ વાત ને સ્વીકારી બીજા ફતવા ઉપર અમલ કર્યો.

થોડા સમય પછી તે માણસ બગદાદ શહેરમાંથી પસાર થયો ત્યારે તેણે શૈખ મુફીદ અ.ર. ને આ વાત કહી. શૈખ મુફીદ અ.ર. એ ફરમાવ્યું “મે તો આ ફતવાની સાથ કોઈની મોકલ્યો ન હતો. એમ લાગે છે કે તે ઘોડે સવાર ઈમામે અસ્ર અ.સ. હતા.” (જેમણે આ તબક્કે મદદ કરી) તે પછી શૈખ મુફીદ અ.ર. ફરમાવે છે કે આ બનાવ થો એમ જણાય છે કે હું ફતવા આપવા અને મરજઈઅત જેવી જવાબદારીને પાત્ર નથી. તે દિવસ પછી પોતાના ઘરનો દરવાજો બંધ કરી દીધો. અને લોકોને કહ્યું હવે મને મસઅલાઓ પૂછવામાં ન આવે.

હજુ સમય પસાર થયો ન હતો કે ઈમામ અસ્ર અ.સ. તરફથી પત્ર મુબારક આવી પહોંચ્યો, જેમાં ઈમામ અ.સ. એ ફરમાવ્યુ “આપ ફતવા આપો. અમે આપને ભુલચુકથી રક્ષણ આપીશું અપને એકલા નહી છોડીએ કે શરત ચુક થઈ જાય”.

ત્યાર પછી શખ મુફીદ અ.ર. એ ઈમામે ઝમાના ના હુકમથી બીજી વખત મરજઈઅતનો બોજ ઉઠાવ્યો અને લોકોને મસઅલાનો જવાબ આપવાનું શરૂ કર્યું. (કસસુલ ઓલમાં પાના નં. ૪૪)

કિસ્સો - ૧૯

ઈમામ અ.સ.ને દરેક વસ્તુની માહિતી
છે.

જનાબ મુફ્ઝઝલે હઝરત ઈમામ જાફરે સાદિક અ.સ. અર્ઝ કરી : હું આપ ઉપર કુર્બાન, શું એ શક્ય છે કે ખુદાવંદે આલમ કોઈ બંદાની ઈતાઅત તમામ લોકો ઉપર વાજીબ કરી દેય. અને આસ્માનની માહિતી તેનાથો છુપાએલી હોય ?

ઈમામ અ.સ. એ ફરમાવ્યુ નહીં. ખુદાવંદે આલમ પોતાના બંદાઓ ઉપર તેનાથો વધુ મહેરબાન ચાહનાર અને દયાવાન છે, કે પોતાના કોઈ બંદાની ઈતાઅત વાજીબ કરી દેય અને આસમાનની ખબરો સવાર સાંજ

તેનાથી છુપાએલી હોય (ઉસુલે કાફી ભાગ -
૧ પાના નં. ૨૫૧ હટીસ - ૩)

આ હટીસોથી સ્પષ્ટ થાય છે કે
આસમાન અને જમીનની બધી ખબરો દરરોજ
સવાર સાંજ ઈમામ અ.સ.ની પાસે રજૂ
કરવામાં આવે છે. અને ઈમામ અ.સ. આપણી
એક એક વાતથી માહિતગાર છે.

અઈમમ્મએ માઅસુમીન અ.મુ.સ. ન
માત્ર આપણી પરિસ્થિતિથી જાણકાર છે.
બલકે તેમને આપણા દુઃખ દર્દોની પણ અસર
થાય છે. નીચેના પ્રસંગ પરથી તેનો અંદાજ
આવી શકશે.

રમીલાનુ બયાન છે, હું હ. અલી
અ.સ.ના ઝમાનામાં જબરજસ્ત બીમાર પડી

ગયો જુમ્આના દિવસે જરા રાહત થઈ. મે વિચાર્યું કે કેટલું સારું થતું, જો હું આજે ગુસ્સા કરીને હ. અલી અ.સ. ની પાછળ નમાઝ અદા કરું મે એમજ કર્યું મસ્જીદે ગયો ત્યારે હઝરત ખુત્બો આપી રહ્યા હતા. મારી હાલત ફરી ખરાબ થઈ નમાઝ પછી જ્યારે હઝરત કસ્ર નામની જગ્યા ઉપર ગયા. તો હું પણ તેમની સાથે હતો. તેમણે મને કહ્યું એ રમીલા તમે કેમ તડપી રહ્યા હતા ? મે મારી બિમારીની વાત કરી અને મારી હાલત જણાવી તે પછી હઝરતે ફરમાવ્યું “એ રમીલા જ્યારે કોઈ મોઅમીન બિમાર હોય છે, ત્યારે અમે તેની બિમારીમાં બિમાર હોઈએ છીએ જો કોઈ દુઃખી કે ગમગીન હોય છે તો અમે પણ તેની સાથ

દુઃખી કે ગમગીન હોઈએ છીએ. જો કોઈ દુઃખી
કરે છે તો અમે તેની દુઃખી પર આમીન કહીએ
છીએ. અને જો કોઈ ચુપ રહે છે તો અમે તેના
માટે દુઃખી કરીએ છીએ.

રમીલાએ અર્ઝ કરી આપની આ
વાતચીત માત્ર એ લોકોની માટે છે, કે જેઓ
આ કસ્ત નામની જગ્યામાં રહે છે. જે લોકો
દુનિયાના બીજા ભાગમાં રહે છે. તેઓના માટે
શું ? ઈમામે અ.સ.મે ફરમાવ્યું એ રમીલા !
દુનિયામાં પૂર્વથી પશ્ચિમમાં કોઈપણ
મોઅમીન અમારી નજરથી ગાએબ નથી.
(ખસાએફલ દરજાત પ્ર. ૧૬ હ. ૧)

આ પ્રસંગથી જરૂર સમજી શકાશે કે
અઈમ્મએ માઅસુમીન અ.મુ.સ. પોતાના

દોસ્તોને કેટલા યાહે છે. એક બાપ પણ પોતાના દિકરાને આટલો નથો યાહતો, જ્યારે અઈમ્મા અ.મુ.સ. આપણી સાથ આટલી મહોબ્બત રાખે છે. તેથી આ મહોબ્બતના ઓછામાં ઓછા બદલારૂપે આપણે એવા કાર્યો કરીએ, જેથી આ મહાન હસ્તીઓ આપણાથી ખુશ થાય અને તે બાબતોથી દુર રહીએ જેનાથી તેઓ નારાઝ થાય.

કિસ્સો - ૨૦

પગના ઝખ્મમાંથી શિક્ષા મળી.

મીઝા મોહમ્મદ સઈદના પગમાં દર્દ શરૂ થયું. ધીરેધીરે બન્ને પગ ઉપર સોજા ચડી ગયા. એ દર્દ એટલે બધું વધી ગયું હતું કે તેઓ સીધા ચાલી શકતા ન હતા. તેથી લંગડાઈને ચાલતા

હતા. તેઓએ ડોક્ટરો પાસે ઈલાજ કરાવ્યો પણ થોડા સમય પુરતુ ફાયદો થયો. થોડા દિવસ પછી પાછો દુઃખાવો શરૂ થઈ ગયો. એટલુજ નહી બન્ને પગમાં રસી થઈ ગયા. તેમજ તેની અસર આખા શરીરમાં થઈ ગઈ. શરીરમાં જગ્યા જગ્યાએથો રસી નિકળતી હતી. તેને કોઈપણ દવાથો કોઈ ફાયદો થતો ન હતો. તેના દર્દમાં દિવસે દિવસે વધારો થતો હતો છેવટે તેની હાલત એવી થઈ ગઈ કે તે જમીન પર પગ માંડી શકતો ન હતો. તેના શરીરમાંથો એટલુ બધુ લોહી વહી ચુક્યુ હતુ. કે શરીર ઉપર માત્ર ચામડી અને હાડકા બાકી રહ્યા હતા. તેને સતત દર્દ થતુ હોવાને કારણે તેનો સ્વભાવ ચીડયો થઈ ગયો હતો. તેની આ

બીમારીને લીધે કુટુંબના બધાજ સભ્યો પરેશાન થઈ ગયા હતા. તેનું આખું શરીર એટલું બધું સડી ચુક્યું હતું કે કોઈ તેના શરીરના એક ભાગ ઉપર હાથ મુકતું તો તે શરીરના બીજા ભાગમાંથી રસી બહાર આવી જતી હતી. યોગાનુયોગ એવો થયો કે એ દિવસોમાં નાઈન શહેરમાં વબા (પ્લેગ) ની બીમારી ફાટી નિકળી હતી. તેથી પ્લેગના ડરથી તે લોકો બીજા ગામ ચાલ્યા ગયા. ત્યાં આકા ચુસુફ નામના એક નિષ્ણાંત તબીબ હતા. તેમને મીઝા મોહમ્મદની તબીયત દેખાડવામાં આવી. લાંબાસમય સુધી જોયા પછી તેણે દર્દીના માસા અબ્દુલ વહાબને ખુલામાં લઈ જઈને કાંઈ કહ્યું. જેનાથી એમ

જણાઈ આવતુ હતુ કે આ નિષ્ણાંત તબીબ પણ તેના ઉપચાર કરવા માટે લાચાર છે. તે પછી તો તેના ઘરના સભ્યોની નિરાશામાં વૃદ્ધી થઈ ગઈ. તેઓ હતાશ થઈ ગયા. એવામાં એવી જાણકારી મળી કે.

એક ગામમાં મીઝા અબુતાલીબ નામનો એક માણસ જે ખુબજ મુત્તકી અને પરહેઝગાર છે. તેની પાસે ઈમામે અસ્ર અ.સ. ની ખીદમતમાં પ્રસ્તુત કરવા માટે એક અરીઝા અને એક ઈસ્તેગાસા છે. જે અરીઝા ખુબજ અસરકારક અને અકસીર છે. બીમાર માણસની માતા મીઝા અબુતાલીબની પાસે પહોંચી. તેણે પોતાના બિમાર ફરઝંદની શફ માટે અરીઝા લખવાની વિનંતી કરી. જુમ્આના

દિવસે તેઓએ એક અરીઝા લખી આપી. બિમાર માણસની માતા તે અરીઝા લઈને એક કુવા પાસે અરીઝા નાખવા માટે ગઈ. જ્યારે તણીએ તે અરીઝા નાખી દીધી તો તે અરીઝા અઘવચ્ચેજ રહી ગઈ આ જોઈને તે સ્ત્રી ખુબજ રડવા લાગી. બીમારના ભાઈએ રાતના એક સ્વપ્ન જોયું કે ઈમામ અસ્ર અ.સ. તશરીફ લાવ્યા છે. તેઓના હાથ મુબારકમાં એક નેઝો છે. જે નેઝાની તેઓ (અજ.) એ મારા ભાઈના પડખા પર રાખ્યો અને ફરમાવ્યું, ઉઠો તમારા માસાનું સ્વાગત કરો (તેના માસા ઘણા સમયથી પ્રવાસમાં ગયા હતા. તેના વિષે કોઈ સમાચાર ન હતા. તેથી તેમના વિષે પણ કુટુંબીજનો ચીંતીત હતા) મારો ભાઈ ઉઠ્યો

અને ઉભો થઈને દરવાજા સુધી માસાના સ્વાગત માટે ગયો. આ સ્વપ્ન જોયા પછી બિમારના ભાઈની આખો ખુદી ગઈ સવારનો સમય છે. ઘરના બધા લોકો સુતા છે. તે તુરંતજ પોતાના બિમાર ભાઈની પાસે આવ્યો તેને જગાડ્યો અને કહ્યું, ભાઈ ઉઠો તમને ઈમામે અસ્ત અ.સ. મે શફા આપી છે.આમ કહેતા તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો. જે બિમાર ભાઈ રાત સુધી જમીન ઉપર પગ પાડા મુકી શકતો ન હતો તે ખુબજ સારી રીતે ઘરમા ચાલી રહ્યો હતો. તેના આખા શરીરમાં રોગનું કોઈ નામો નિશાન ન હતું. તે અરીઝા અને ઈસ્તેગાસા નીચે મુજબ છે.

ઉપર મુજબની અરીઝા લખીને વહેતા પાણીમાં અથવા કુવામાં નાખી દેવી અને તે વખતે નીચે મુજબ કહેવું યા ઉસ્માન બીન સઈદ, વ યા મોહંમદ બીન ઉસ્માન, અવસેલા કિસ્સત એલા સાહેબીઝઝમાન સલવાતુલ્લાહે અલયહ.(ઈરફાન ઈમામત કિસ્સો-૧૦૯)

કિસ્સો - ૨૧

હાજી અલી બગદાદીને ઈમામ (અ.સ.)

ની મુલાકાત

અધામા હાજી મીરઝા હુસેન નુરી પોતાની કિતાબ “નજમુસ્સાકીબમાં” લખે છે વળી તેજ બનાવને હાજી શેખ અબ્બાસ ઉમ્મી કીતાબે “મફ્તાતીહુલ જુનાન માં નીચે પ્રમાણે લખે છે કે :

હાજી અલી બગદાદી કહે છે કે મારી પાસે
હકકે ઈમામના ૮૦ તુમાન (સીકકા પૈસાના)
હતા. હું નજફ ગયો ને તેમાના ૨૦ હાજી શેખ
મુરતુજા અન્સારી મુજતહેદને આપ્યા અને
બીજા ૨૦ હાજી શેખ મોહમ્મદે હુસૈને મુજતહેદે
કાઝેમૈનને આપ્યા બીજા ૨૦ શેખ મોહમ્મદે
હસને સુરકી મુજતહેદને આપ્યા પછી હું
બગદાદથી કાઝમૈન ઝિયારત માટે ગયો. અને
ત્યા શેખ મોહમ્મદ હસન કાઝેમૈની (જે
યાસીનની ઓલાદમાંથી હતા.) તેની મુલાકાત
કરી અને બાકીના ૨૦ માથો થોડા તેમને
આપ્યા. પછી ઝિયારત કરી હું જવા માંગતો
હતો પણ શેખ મોહમ્મદ હસને કાઝમૈનીએ
મને રોકાવાનું કીધું. પણ મે કીધું કે આજ રાતે

મારે મારા કારખાનાના મજુરોને મજુરી દેવાની છે .એટલે મેં બગદાદ તરફ ચાલવા માંડ્યું.

આગળ જતાં મે એક તેજસ્વી પુરૂષને જોયા. તેણે આવી મને સલામ કરી, મુસાફો લીધો. અને બગલગીરી કરી, તેમણે લીલો ફેટો માથા પર બાંધ્યો હતો. તેમના જમણા ગાલ પર તલનો ડાઘ હતો. તેમણે મને પૂછ્યું કે તું ક્યાં જાય છે? મે કીધું કે કામ હોવાથી ઝિયારત કરી હું પાછો બગદાદ જાઉ છું. તેમણે કહ્યું કે તું પાછો ફર અને આજ જુમ્હાની રાત છે માટે ઝિયારત કર. અને હું ક્યામતમાં સાક્ષી આપીશ કે તું મારા દાદા હઝરતે અલી અ. નો શીયા,દોસ્ત છે. અને તે શોખ પણ તારા માટે સાક્ષી પણ આપશે. (આ વખતે હાજી અલી

મનમાં વિચારતો હતો કે હું તે શોખ મોહમ્મદ હસન પાસેથી ચીઢી લખાવીશ અને મારા કફનમાં રાખીશ. તેથીજ પેલા નવા આવનાર માણસે કહ્યુ કે તે શોખ પણ તારા માટે સાક્ષી આપશે) ત્યારે હાજી અલીએ કહ્યુ કે મેં પુણ્યુ તે માણસ ને આપે કેવીરીતે જાણ્યુને, મને કેવીરીતે ઓળખ્યો ? ત્યારે તેમણે કહ્યુ કે શું તે માણસ કે જેનો હક બીજો માણસ આપે તેને તે ન ઓળખી શકે ? ત્યારે મેં પુણ્યુ કે કયો હક ? તો તેઓએ કહ્યુ કે તે હક કે જે તેં અમારા વડીલોને આપ્યા છે. મેં પુણ્યુ કે કયા વડીલો ? તેઓએ કહ્યુ શોખ મોહમ્મદ હસન અને વગેરે. મેં મનમા કહ્યુ કે આ માણસ મને ઓળખે છે. અને હું તેને ભુલી ગયો લાગુ છું.

મારા મનમાં થયું કે આ માણસને ઈમામના હકની જરૂર છે. તેથી મેં તેને કહ્યું કે એ સરદાર હું શૈખ મોહમ્મદ હસનની રજાથી તને ઈમામનો હક આપીશ તો તેણે હસીને કહ્યું કે તે મારો હકક આપીદીધો છે. ત્યારે મેં પૂછ્યું કે શું તે કબુલ થયો છે. તેમણે કહ્યું હા. ફરી મેં પૂછ્યું કે શું આલીમો તમારા વકીલો છે? તેમણે જવાબ આપ્યો “હા”.

પછી તેમના કહેવાથી હું પાછો ફર્યો અને અમે કાઝમેન તરફ જવા લાગ્યા મેં જોયું કે જે રસ્તો પેલા સુકો હતો. તે અત્યારે કુલ ફળાદી અને વૃક્ષોથી લીલો છમ થઈ ગયો છે. અને વૃક્ષોને લીધો રસ્તા પર છાયો પડતો હતો. એક બાજુથી સફેદ પાણીનો ઝરો વહેતો હતો.

મે અજાયબીથી તેને પુછ્યુ કે આ બધુ શું છે ? તેમણે કીધુ કે જે લોકો અમારા દાદાની ઝીયારત કરે છે તે લોકોને આ બધા ફાયદા મળે છે. તેથી હું ઘણોજ ખુશ થયો. તેમજ જરા વિચારવા પણ લાગ્યો કે આ માણસ કોણ છે? તેથી ખાતરી ખાતર મેં તેમને અમુક સવાલો પૂછ્યા, તે આ પ્રમાણે છે.

(૧) મે તેમને પુછ્યું કે મેં શેખ અબ્દુર રઝઝાક મહુમથી સાંભળ્યુ છે કે જે માણસ દિવસે રોઝો રાખે, રાત ભર ઈબાદત કરે, ચાલીસ હજ કરે અને સફા અને મરવાની વચ્ચે મરણ પામે અને તે હ. અલી અ.સ. નો દોસ્ત ન હોય તો તે બધુ નકામુ છે. તો મે

તેમને પુછ્યુ કે શું આ સાચુ છે. ? તો તેમણે જવાબ આપ્યો કે ‘હા’

(૨) મે પુછ્યું કે શું એક માણસ કે જે મારો સગો છે તે હ. અલી અ.સ. ના દોસ્ત માંથો છે કે નહીં. ? તેમણે જવાબ આપ્યો ‘હા’.

(૩) આલીમો કહે છે કે એક વખત સુલેમાને અઅમશ કોઈની પાસે ગયો અને ઈમામ હુસૈન અ.સ. ની ઝીયારતના બારામાં પુછ્યુ તો તેણે જવાબ આપ્યો કે તે બીદઅત છે ત્યાર પછી સુલેમાને સ્વપ્નમાં એક પાલખી જમીન અને આસમાનની વચ્ચે જોઈ તેમા જનાબે ફાતેમા સ.અ. અને જનાબે ખદીજા સ.અ. હતા અને તેઓ જુમ્આની રાત હોવાથી

હ. ઇમામ હુસૈન અ.સ.ની ઝીયારત માટે જતા હતા. પાલખીમાંથી નાના નાના કાગળના ટુકડા ફેંકાતા હતા. અને તેમા લખેલુ હતું કે જેઓ ઇ. હુસૈન અ.સ.ના ઝલ્વારો છે, તેઓ કયામતના દિવસે દોઝખની આગથી બચી જશે. શું તે વાત સાચી છે ? તેમણે જવાબ આપ્યો ‘હા.’

(જ) શું હ. ઇમામ હુસૈન અ.સ. ની ઝીયારત લોકોના માટે એક અમાન છે, તેમણે જવાબ આપ્યો કે ‘હા’, અને તેમની આંખ માંથી આંસુ સરી પડ્યા.

(પ) મે તેમને સવાલ કર્યો કે દરોદ ગામમાં મને એક તુર્કી અરબ મળ્યો તે ઇમામે રઝા અ.સ. ની ઝીયારત કરી પાછો ઘરે જતો

હતો. મે તેને આમંત્રણ આપ્યું અને પૂછ્યું કે ઈમામે રઝા અ.સ. નું શહેર કેવું છે? તો તેણે કીધું કે તે જન્નત છે. અને તેણે ત્યાં ૧૫ દિવસ મોલાનું અનાજ ખાધું હતું. એટલે તેને કબરમાં મુન્કીર અને નકીર ફરીશતા સતાવશે નહીં. કારણ કે તેનું ગોશ્ત અને લોહી ઈમામના ખોરાકથી સાફ બન્યા છે. અને ઈમામે રઝા અ.સ. કબરમાં આવી બચાવશે. શું આ વાત સાચી છે ? તેમણે જવાબ આપ્યો ‘હા’.

ફરી પાછા મે તેમને સવાલો પૂછવા શરૂ કર્યું. મે તેમને પુછ્યું કે મે પણ ઈમામ રઝા અ.સ.ની ઝીયારત કરી છે,શું તે કબુલ થઈ છે? તેમણે કીધું ‘હા’,શું મારા દોસ્ત હાજી મોહમ્મદ બજ્જાજ બાશી જે મારી સાથ

મુસાફરીમાં હતા. તેની પણ ઝિયારત કબુલ થઈ છે ? તેમણે કહ્યું ‘હા’. વળી બીજો એક માણસ બગદાદી કે જે મારી સાથે હતો તેની પણ ઝિયારત કબુલ થઈ છે? ત્યારે તેમણે જવાબ આપ્યો નહીં, એટલે હું તરતજ સમજી ગયો કેમકે તે માણસ સારો ન હતો. વળી તેણે પોતાની માતાને મારી નાખી હતી.

તે પછી અમો ચાલવા લાગ્યા અને એક રસ્તા પર આવ્યા કે જે ચત્તીમોનો રસ્તો કહેવાતો હતો. જો કે તે રસ્તેથી જવા માટે હું તો નારાઝ હતો પણ જ્યારે તેમણે કહ્યું કે આ માર્ગ મારા દાદા અમીર અ.સ. નો છે. અને હ. અલી અ.સ. ના દોસ્તો માટે તે રસ્તા પર ચાલવું જાએઝ છે. ત્યારે અમે ત્યાંથી

ચાલ્યા,તે રસ્તા પર એક બાગ હતો. તેના માલિક હાજી મીઝા હાદી હતો. વળી તે અજમનો પૈસાદાર હતો ત્યારે મે તેમને પુછ્યુ કે આ બાગ ઈમામે રઝા અ.સ. નો છે. અને તેમનાથો છીનવાઈ લેવાયો છે ? તેમણે કીધુ કે ચુપ રહો. ત્યાંથો આગળ ચાલતા નાની નદી આવી ત્યા આગળ બે રસ્તા હતા. એક રાહે સુલતાની હતો. અને બીજો રાહે સાદાતી હતો. અમો રાહે સાદાતીથો ગયા. થોડા પગલા પછી મે જોયુ કે અમો ઈમામે મુસા અ.સ.ના રોઝાના સહેનમાં હતા. પછી બાબુલ મુરાદના દરવાજામાંથો હરમમાં દાખલ થયા. ત્યા તેમણે મને ઝિયારત પડવાનું કીધુ. અને મારા માટે તેમણે ઝિયારત પડવી શરૂ કરી. ઝિયારતમાં

તેમણે અગીયાર ઈમામોના નામ લીધા. અને અગીયારમાં ઈમામના નામ વખતે કીધુ કે અસ્સલામો અલયકુમ યા અબા હસન અસ્કરી પછી તેમણે મને કીધુ કે શું તું તારા ઝમાનાના ઈમામને ઓળખે છે?

મે જવાબ આપ્યો 'હા', તેમણે કહ્યું કે તો પછી તું તારા ઝમાનાના ઈમામ પર સલામ કર. તેથી મે કીધુ અસ્સલામો અલયકુમ યા હુજજતલાહે સાહેબુઝઝમાન યા અબલ હસન. તેઓ હસ્થા અને જવાબ આપ્યો કે અલરકસ્સલામ.પછી રોઝાને ચુમ્યા પછી મે કહ્યુ કે હવે બીજી ઝિયારત પડો.તેથી તેમણે ઝિયારતે અમીનુલ્લાહ પડવાની શરૂ કરી. એટલામાંતો બત્તીઓમાંની એક બત્તી સુરજ જેવી પ્રકાશીત

બની.તે પછી ઈમામ હુસૈન અ.સ.ની ઝિયારત કરી.તેવામાં મગરીબની નમાઝની અઝાન થઈ ગઈ. તેથી અમો બાજુની મસ્જિદમાં ગયા. તેમણે મને કહ્યું કે તું નમાઝે જમાઅતમાં શરીક થઈ જા.તેથી હું નમાઝમાં શામીલ થઈ ગયો અને પોતે ઈમામની બાજુમાં નમાઝ પડવા લાગ્યા.જ્યારે નમાઝ પુરી થઈ તો મને પાછા તેઓ ન જ દેખાયા પછી મેં ઘણીજ શોધ કરી. પરંતુ તેઓ મને ન મળ્યા. પછી હું વિચાર કરવા લાગ્યો કે તેઓ કોણ હશે? કે જેમણે મને આટલા સવાલના જવાબ આપ્યા. મોઅજ્જા બતાવ્યા.ઝિયારત પડતા મેં સલામ કરી તો તેણે જવાબ આપ્યો. નાછુટકે મેં આખી રાત ઘણીજ બેચેનીમાં પસાર કરી.

સવારે હું ત શૈખ મૌહમ્મદ હસન પાસે ગયો
અને બધી વાત તેને કહી સંભળાવી. તેણે મને
કીધું કે ચુપ રહો અને કાંઈ ન બોલો. તે પછી
એક મહિને તેજ હરમમાં મે એક સૈયદને
જોયા.તેમણે મને પુછ્યું કે એક માસ પહેલા
તારી સાથ શું બનાવ થયેલો. તું મને કહે પણ
હું ચુપ રહ્યો, એટલા માં તો પાછા તે સૈયદ
ગાએબ થઈ ગયા.(ઈસ્કાન ઈમામત,કિસ્સો :
૭૮)

કિસ્સો - ૨૨

ગયબતે ઇમામ અ.સ. માં આપણી
જવાબદારી :

ઇમામ હુસૈન અ.સ. ઉપર ૨૬વું.

આ એક એવું કાર્ય છે, કે જેનાથી ઇમામ અ.સ.ના હકકો અદા થાય છે. અને તેમાં કોઈ શંકા નથી કે ઇમામે ઝમાના અ.સ. ના હકક અદા કરવો તે અદાહની નઝદીકી પ્રાપ્ત કરવાનું એક ખાસ અને મહાન માધ્યમ છે. જાઅફર ઇબ્ને મોહમ્મદ ઇબ્ને કોલવરહે કુમ્મી અ.ર.પોતાની કિતાબ કામીલુઝ ઝિયારતમાં સનદ સાથે ઇમામ સાદિક અ.સ. ઇમામ હુસૈન અ.સ. ઉપર ૨૬વાની ફઝીલતની એક લાંબી હદીસનું વર્ણન કરે છે “કોઈ આંખ

કે કોઈ આંસુ અઘાહની નઝરમાં તે આંખથી વધારે પસંદ કરવા લાયક નથી, જે ઈમામ હુસૈન અ.સ. ઉપર રડે અને આંસુ વહાવે અને કોઈ રોવાવાળો ઈમામ હુસૈન અ.સ. માટે નથી રડતો, બલકે તેણે જનાબે ફાતેમા ઝહેરા સ.અ. ને એક ભેટ આપી. અને તેમના વિલાપમાં (ગમમાં) તેમની મદદ કરી અને રસુલે ખુદા સ.અ.વ. ને એક ભેટ આપી અને મારા હકકને અદા કર્યો કયામતના દિવસે દરેકને રોતી આંખો સાથે ઉભા કરવામાં આવશે, સિવાય તેને કે જેઓ મારા મઝલુમ દાદા ઈમામ હુસૈન અ.સ. પર રડતા હતા. કેમકે જે તેમના પર રડ્યા હશે તેમની આંખો ચમકતી હશે. તેમને ખુશ ખબરી આપવામાં આવશે અને તેમના

ચહેરા પરથી ખુશી ટપકતી હશે. તમામ સર્જનો તેમના પરિણામ બાબત ભયમાં હશે, સિવાય તેઓ કે જેઓ ઈમામે મઝલુમ અ.સ. ઉપર રડવાવાળા હશે. તેઓ સંપૂર્ણ સલામતીમાં હશે. બધા લોકો મહેશરના મેદાનમાં ભેગા થશે.જ્યારે આ લોકો અર્શની નીચે છાયામાં ઈમામ હુસૈન અ.સ. સાથ વાતો કરતા હશે. તે લોકો હિસાબના દિવસની કડકાઈથી ડરશે નહી. તેઓને જન્નતમાં દાખલ થવાનું કહેવામાં આવશે. પરંતુ તેઓ તેમ નહીં કરે,તેઓ જન્નત કરતા ઈમામ હુસૈન અ.સ. નો સહવાસ વધુ પસંદ કરશે. જન્નતની હુરો તેઓને સંદેશો મોકલતી હશે કે તેણીઓ આ લોકોની રાહ જોઈ રહી છે.તેમ છતા,તેઓ ઈમામ હુસૈન

અ.સ.ની વાતચીતથી એટલા પ્રસન્ન હશે કે હુરો તરફ ધ્યાન નહીં આપે. (કામેલુઝ ઝીયારત ભાગ-૨૬, પે. ૮૧)

ઉપર દર્શાવેલ વાક્યો ‘મારા હકને અદા કર્યો’ સુચવે છે કે ઈમામ હુસૈન અ.સ. ઉપર રડવું તે એક એવું કાર્ય છે, કે જે ઈમામે ઝમાના અ.સ. અને બીજા પવિત્ર ઈમામો અ.સ. ના હકને અદા કરવાનું કારણ બને છે.

કિસ્સો - ૨૩

આપણી ઈમામ અ.પ્રત્યે ની ફરજ:

ઈમામના

વિયોગના દુઃખમાં શોકમગ્ન બનવું.

ઈમામ સાદિક અ.સ. એક લાંબી હદીસમાં ફરમાવે છે, કે : દુનિયામાં એક પણ

આંખ જે અમારી મુસીબતો પર દુઃખી થશે તો તેઓ આખેરતમાં અમને હલ્કે કૌસર સિવાય બીજી કોઈ જગ્યાએ નહીં મળે. (બેહારુલ અન્વાર ભાગ ૮ પા.૨૨ હદીસ નં.૧૭) અન્ય હદીસમાં ઈમામ અ. ફરમાવે છે કે : જો કોઈ માણસનું દિલ આ દુનિયા માં અમારા પર થતાં ઝુલ્મો બદલ દુઃખી થાય તો તેનો દરેક શ્વાસ ‘તસ્બીહ’નો સવાબ રાખે છે. (ઉસુલે કાફી હદીસ નં.૩ પાના નં.૩૨૦)

તસ્બીહનો સવાબ કેટલો? હ.અલી અ.ની હદીસ પ્રમાણે તસ્બીહનો સવાબ એ છે કે “જ્યારે ઈન્સાન ‘સુબ્હાનલ્લાહ’ કહે છે ત્યારે તમામ ફરિશ્તાઓ તેના પર રહેમત (પ્રસંશા) નાઝિલ કરે છે. (તપહીદે સદુક ભાગ ૧ પાના

નં.૩૧૨) બીજી એક હદીસમાં ઇમામે સાદિક અ. ફરમાવે છે કે : આખર ઝમાનામાં લોકો (અમારા કાએમ - ઇમામે ઝમાના અ. વિશે) કહશે કે તેઓ ઇન્તકાલ કરી ગયા છે. કેટલાંક કહશે કે તેઓ કોઈ ખીલામાં ગાએબ થઈ ગયા છે. પરંતુ મોમિનો તેઓની જુદાઈમાં રડી ઉઠશે.(ગયબતે નૌમાની આખર ઝમાના વિશેના પ્રકરણમાં પાના નં.૭૭)

ઇમામ મુસા કાઝીમ (અ.) ની હદીસ મૂજબ (ગયબતના) આખર ઝમાનામાં જ્યારે કાએમ (અ.) નું નામ લેવામા આવશે ત્યારે શિયાઓની આંખો આંસુઓથી ભરાઈ જશે. એવા શિયાઓ કયામતમાં અમારી સાથ

હશે.તેઓ અમારાથી ખુશ હશે અને અમે તેમનાથી રાજી હોઈશું.

કિસ્સો - ૨૪

આપણી ત્રીજી જવાબદારી : ઈન્ટેઝાર

ઈન્ટેઝાર કોઈને પણ ચાહવાનું પરિણામ એ હોય છે, કે તેની ગેરહાજરીમાં તેમને યાદ કરવામાં આવે અને આતુરતાપૂર્વક તેમની રાહ જોવામાં આવે.

આ વાતને એક દાખલા થકી સમજીએ. જ્યારે કોઈ સંતાનોના પિતા પોતાના વતનથી દુર કોઈ ગામમાં નોકરી કરતા હોય અને તે જ્યારે તેના બાળકો સાથે ફોન પર વાત કરે ત્યારે સ્વાભાવિક રીતે જ પહેલો સવાલ એ હોય છે કે : “પપ્પા, તમે ઘરે ક્યારે આવશો?

”આવો સવાલ પુછવાનું બાળકને શીખવવામાં આવતું નથી.પરંતુ આ આંતરસ્ફુરણા અને બાળકના પિતા પ્રત્યેની કુદરતી મોહબ્બતના કારણે પુછવામાં આવતો હોય છે. આટલુંજ નહીં,બાળક પોતાના પિતાને સતત યાદ કરતા રહે છે તેમજ તેમના મિત્રો સાથે રમતાં રમતાં એવું કહેતા સાંભળવા મળે છે કે : મારા પિતાએ કહ્યું છે કે : તેઓ ટુંક સમયમાંજ આવનાર છે. આપણો ઈમામે ઝમાના અ. પ્રત્યેનો પ્રેમ પણ નાના બાળકોનો તેના પિતા પ્રત્યેના પ્રેમની જેમ સ્વભાવિક, શુદ્ધ અને કુદરતી હોય તો કેટલું સારૂ થાય!? બેશક ઈમામ (અ) નો ઈન્તેઝાર કરવો ઈમામ પ્રત્યેની મોહબ્બતની નિશાની

છે. જે વિશે ઈમામ સાદિક (અ.) ફરમાવે છે.
“ઈમામના ઝહુર માટે સવાર અને સાંજ
ઈન્તેઝાર કરો.” એક શાયરે બહુજ સુંદર
શબ્દોમાં ઈમામ અ.ના ઈન્તેઝારની વાત ને
આ રીતે રજુ કરી છે:- અદ્દાહ ગવાહ છે, કે હું
આપને યાદ કરતો નથી પરંતુ હું આપને યાદ
કઈ રીતે કરું ! જ્યારે કે હું આપને ભુલ્યો જ
નથી ! (મીકીયાલુલ મકારીમ ભાગ-૨ વાના
નં.૩૦૮)

બેશક ઈન્તેઝારનો સાચો અર્થ એ છે કે
આપણા દિલોમાંથી આપણા ઈમામ અ. નો
યાદ કદી ભુલાવી ન જોઈએ. આપણામાંથી જે
કોઈ સાફ દિલ, ખુલુસ નિર્યત અને
મોહબ્બતની લાગણી સાથે ઈમામે ઝમાના અ.

ના ઝહુરનો ઇન્ટઝાર કરતા હોય તો તેઓ એક ખાસ સ્થાન અને મહત્વ ધરાવે છે જે વાત નીચે મુજબની હદીસોથી સ્પષ્ટ થાય છે.

(૧) ઇમામે જાફર સાદિક અ.સ. ફરમાવે છે કે : જે કોઈ આ દુનિયામાંથી કાએમ અ.ના ઇન્ટેઝાર (કરતા હોવાની) હાલતમાં વિદાય લેય તો તે જાણેકે અમારા સાથ અમારા તંબુમાં હતો. (કમાલુદ્દીન ભાગ ૨ પા.૬૪૪ હદીસ નં.૧.મિકીયાલુલ મકારીમ ભાગ ૨ પા.૨૦૬ પર્શીયન આવૃત્તિ).

(૨) બીજી હદીસમાં ઇમામે સાદિક અ.ફરમાવે છે કે જે કોઈ અમારી હુકુમતનો ઇન્ટેઝાર કરે, તો તે અદ્લાહ (સુબ્હાનહુ વ તઆલા) ની રાહમાં પોતાના લોહીથી નહાવા

સમાન છે (કમાલુદ્દીન ભાગ ૨
પા.૬૪૫,હદીસ નં.૬ અને
મીકીયાલુલ મકારીમ ભાગ ૨ પાના ૨ નં.૨૦૭
પર્શીયન આવૃત્તિ)

(૩) અન્ય હદીસમાં ઇન્તેઝારના કામના
મહત્વ પર ભાર આપીને ઇમામે સાદિક અ. એ
ફરમાવ્યું કે : એ શિયાઓ ખુશનસીબ છે,કે
જેઓ ગયબતના ઝમાનામાં તેમના ઇમામ
અ.નો ઇન્તેઝાર કરે. તેવા લોકો અદ્લાહના
દોસ્ત છે. તેવા લોકોને ડર નહીં હોય અને ન
તો તેઓ દુઃખી થશે.(કમાલુદ્દીન ભાગ ૨
પા.૩૫૭,હદીસ નં.૫૪ અને મીકીયાલુલ
મકારીમ ભાગ ૨ પાના ૨ નં.૨૦૭ પર્શીયન
આવૃત્તિ).

(૪) મુઝફ્ફર ઇબ્ને ઉમર કહે છે : એક વખત મેં ઇમામ જાફર સાદિક અ.ની હાજરીમાં હઝરત કાએમ અ.ને યાદ કર્યા તેમજ એવા લોકોને યાદ કર્યા કે જેઓ ઇમામ અ.નો ઇન્તેઝાર કરતા કરતા દુનિયાથી વિદાય થઈ ગયા હતા. ત્યારે ઇમામે સાદિક અ. એ જવાબ આપ્યો કે : જ્યારે ઇમામે ઝમાના અ. ઝહુર ફરમાવશે ત્યારે ઇમામ અ.સ. એવા લોકોની કબ્રની પાસે જશે અને તેઓને તેમના નામ લઈને સંબોધન કરશે અને ફરમાવશે કે તમારા ઇમામે ઝહુર કર્યો છે. જો તમે ઇચ્છો તો આવો અને તેમની સાથ જોડાઈ જાવ. (ગેબતે શૈખ તુસી પાના નં.૨૭૬અને મીકીયાલુલ મકારીમ

ભાગ ૨ પાના ૨ નં.૭ પર્શિયન આવૃત્તિ).

(૫) હ.અમીરૂલ મોઅમેનીન અ.સ. એ ફરમાવ્યું “જે લોકો આ દુનિયામાં અમારા હુકમોનું પાલન કરશે તેઓ આખેરતમાં અમારી સાથ ઉચ્ચ દરજ્જા પર હશે, અને જે લોકો અમારી હુકુમતનો ઈન્તઝાર કરે છે. તેઓ એવા છે કે તેઓએ જાણે કે અદ્દાહ (તઆલા) ની રાહમાં દરિયામાં ડુબકી લગાવી હોય. (બેહારૂલ અનવાર ભાગ-૫૫ પાના નં.૧૨૩ હદીસ નં.૭ મીકીયાલુલ મકારીમ ભાગ ૨ પાના ૨ નં.૨૧૦ પર્શિયન આવૃત્તિ)

(૬)ઈમામે જાફર સાદિક અ. એ ફરમાવ્યું “ જે કોઈ પોતાના ઝમાનાના

ઈમામનો ઈન્ટેઝાર કરતા કરતા મૃત્યુ પામે તે ઈમામ અ.સ. ના તંબુમાં તેઓ સાથ હાજર હોય તેવા લોકો સમાન છે.” ત્યાર પછી ઈમામ થોડીવાર રોકાઈ ગયા અને ફરમાવ્યું “ના,તેવા લોકોનો દરજ્જો ઈમામની સાથ રહીને ઈમામ અ.સ.ના દુશ્મનો સામે તલવારથી લડનાર જેવો છે.” ત્યાર પછી થોડીવાર અટકીને ઈમામે આગળ ફરમાવ્યું “ના,તેવા લોકોનો દરજ્જો પયગંબરે ઈસ્લામ (સ.અ.વ.) સાથ રહી લડાઈમાં શહીદ થનાર જેવો છે”(બેહાઝલ અન્વાર ભાગ -૫૬ પાના નં.૧૨૬ હદીસ નં.૧૮)

(૭) ઈમામ મોહંમદ બાકિર અ.સ. એ ફરમાવ્યું “ઈમામ અ.નો ઈન્ટેઝાર કરવાની

હાલતમાં આ દુનિયાથી વિદાય લેનાર માટે નુકશાન નથી કેમકે તે એવા સૈનિકોની જેમ મૃત્યુ પામે છે, જે હ.કાએમ અ.સ.ની સાથે તેઓના તંબુમાં હાજર હોય” (ઉસુલે કાફી ભાગ ૧ પાના નં.૩૭૬ હદીસ નં.૧ અને મીકીયાલુલ મકારીમ ભાગ ૨ પાના નં.૨૧૩ પર્શીયન આવૃત્તિ)

(૮) ઈમામ મોહંમદ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું “હ.કાએમ અ.સ.ના ઝહુરનો ઈન્તેઝાર કરવાનો સવાબ તેના જેવો છે કે કોઈ દિવસના સમયમાં રોઝા રાખે અને રાત ઈબાદતમાં વિતાવે” (ઉસુલે કાફી ભાગ ૨ પાના નં.૨૨૨ હદીસ નં.૪ અને મીકીયાલુલ મકારીમ ભાગ ૨ પાના નં.૨૧૩ પર્શીયન

આવૃત્તિ) વ્હાલા વાંચકો, પવિત્ર ઈમામોની ઉપરોક્ત હદીસો આપણને ઈમામ અ.સ.ના ઈન્તેઝારનું મહત્વ અને મૂલ્ય સ્પષ્ટ કરવા માટે પૂરતી છે.આ બધી હદીસો આપણને ઈમામ અ.સ. પ્રત્યેની મોહબ્બતમાં વધારો કરવા માટે અન ઈમામ અ. ના ઝહુરનો ઈન્તેઝાર કરવા માટેના પ્રયત્નો માટે જાગૃત કરવા પ્રોત્સાહીત કરે છે.

આ વિષયમાં આગળ વધતા આપણે આપણા હૃદયના ઉંડાણમાંથી એ સવાલનો જવાબ મેળવીએ કે “શું આપણે ઈમામ અ.ના ઝહુર થવા વિશે ભય અનુભવીએ છીએ?” સ્વાભાવિક રીતે એક માણસ એવીજ વ્યક્તિનો ઈન્તેઝાર કરે છે જેનાથી તેને કોઈ

દહેશત કે ઘાસ્તી ન હોય તેમજ એવીજ વ્યક્તિનો ઇન્ટેઝાર કરવામાં આવે છે જેનો પોતાની પર કોઈ હક કે દાવો ન હોય.દા.ત.એક ચોર કદી પણ પોલીસનો ઇન્ટેઝાર કરતો નથો કે એક શરાબી મસ્જીદના મૌલાના પોતાની સામે આવે તેવી પ્રતીક્ષા કદી કરતો નથો.આપણે સાચા અર્થમાં ઇન્ટેઝાર કરનાર ત્યારે જ ગણાશું, જ્યારે ગૈબતના ઝમાનામાં ગુનાહોથો દૂર રહેવાના ગંભીરતાપૂર્વક પ્રયત્ન કરીશું.

સાથોસાથ ઇમામને હંમેશા હૃદયપૂર્વક યાહતા રહીશું.અહીં અમે એક વિદ્વાન માણસે સામાજીક વ્યવહાર કે દંભ વિશે કરેલી વાતને પ્રસ્તુત કરીએ છીએ. દા.ત. સમાજના અમુક

વાલીઓની એવી ફરિયાદ હોય છે, કે “અમે શું કરીએ? અમારા બાળકો એટલા બધા જીદ્દી કે હઠીલા છે કે અમારી વાત માનતા નથી. તેથી અમારે ફરજિયાત ટેલીવીઝન જોવું પડે છે.” એ લોકો બાળકોથી તો ડરે છે પરંતુ ગુનાહ કરવામાં અદાહ અને તેના ઈમામથી ડરતા નથી. આપણે અદાહ તઆલા પાસે કુરઆને મજીદની નીચેની આયત આપણા દિલોમાં હંમેશા રહે તે માટે દુઆ કરીએ “શું તમે નથી જાણતા કે અદાહ તમને જુએ છે ?”

ક્રિસ્તો - ૨૫

ઇમામે અસ્ર (અ.સ) ના શિયાઓ સાથ
દોસ્તી કરવી અને મદદ રૂપ થવું.

(૧) હ. ઇમામ અલી રેઝા (અ.સ.)
એ ફરમાવ્યું : “જો કોઈ જરૂરતમંદ શિયાને
મદદ કરે (તેના પર અહેસાન કરે તેની સાથ
સંબંધો જાળવે) તો તે અમને મદદ કરવા તથા
અમારી સાથ સંબંધો જાળવવા સમાન
છે.” (કામિલુઝ ઝિયારત : પાના નં.૩૧૯).

(૨) હ.ઇમામ મુસા કાઝીમ
(અ.સ.)ફરમાવે છે : “જો કોઈ શિયા તમારી
પાસે તેની હાજત લઈને આવે તો એમ સમજો
કે અદાહે તમારા પર દયા કરી છે. અને તમારા
માટે તેની રહેમતના દરવાજા ખોલી નાખ્યા છે.

બેશક જો તે જરૂતરમંદની મદદ કરે તો તે પોતાને (તેના કાચં થકી) અમારી નઝદીક કરશે. આ કામ સાચે જ અદ્દાહની વિલાયત મેળવવા સમાન છે.” (બેહારૂલ અનવાર : ભાગ-૭૪ પાના નં.૪૧૩)

(૩) ઈમામ જઅફરે સાદિક (અ.સ.) એક હદીસમાં ફરમાવે છે કે ખુદાની કસમ, જો કોઈ અમારા શિયાઓમાંથી ફક્ત એક માણસને ખુશ કરે તો તે અમને ખુશ કરવા સમાન છે. ત્યારે પછી ઈમામ આગળ ફરમાવ્યું : ના, તે પયગમ્બર (સ.અ.વ.) અને અદ્દાહને ખુશ કરવા સમાન છે.

(૪) ઈમામ મુસા ઈબ્ને જઅફર સાદિક (અ.સ.) એક હદીસમાં ફરમાવે છે.: “જે કોઈ

અમારા એક શિયાની હાજત પુરી કરે તો તે અમો અહલેબૈત (અ.સ) ની હાજત પુરો કરવા સમાન છે”.

(૫) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું : “જો કોઈ માણસ પોતાના મોમીન ભાઈની મદદનો પ્રયત્ન અદાહની ખુશી માટે અને આખેરતની ભલાઈ માટે કરે તો તે એક હજાર વર્ષ સુધી એક પણ ગુનાહ કર્યા સિવાય અને આંખનો પલકારો માર્યા વગર અદાહની મદદ કરવા સમાન છે. (કમાલુદ્દીન : પાના નં.૫૪૧)

ઉપરોક્ત હદીસોથો એ વાત સ્પષ્ટ થાય છે. કે હ.અલી (અ.સ.) ના શિયાઓને ઈમામની ગૈબતના ઝમાનામાં મદદ

કરવી, તેમની હાજતોને પુરી કરવાનો બદલો પવિત્ર ઈમામોને મદદ કરવાના બદલા સમાન છે.

બેશક જો કોઈ બાળકને તના મા બાપની ગેરહાજરીમાં મદદ કરવામાં આવે તો તે બાળકના મા બાપ જ્યારે પાછા ફરે ત્યારે તેના બાળકને કરવામાં આવેલી મદદને પોતાના પર કરવામાં આવેલા એહસાન સમાન ગણે છે.

ઈમામ હસન અસ્કરી (અ.સ.) ની હદીસ અત્રે પ્રસ્તુત કરવામાં આવે છે, જે તમામ વાતોનો સાર એ છે કે ગૈબતે ઈમામ (અ.સ.)ના ઝમાનામાં કોઈ જાહિલને

મઝહબની વાત શીખવવી એ-એહલેબૈત
(અ.સ.)ના બાળકના માથા
પર પ્રેમથી હાથ ફેરવ્યા સમાન છે. (ઈમામ
અ.ની ગૈબતના જમાનામાં શિયાઓ
ચતીમ/અનાથ છે.) આ કાર્યનો બદલોએ છે
કે બાળકના માથા ઉપર હાથ ફેરવતી વખતે તે
બાળકના માથાના જેટલા વાળ ઉપર હાથ ફેરવે
તેટલી સંખ્યા પ્રમાણે તેના ગુનાહો માફ કરી
દેવામાં આવશે.

બેહાઝલ અનવારના બીજા ભાગમાંથી
મિરઝા મોહંમદ બાકીર ફકીહે ઈમામ (અ.) ની
એક હદીસ નોંધી છે.તેનો સાર આ પ્રમાણે છે.
એક અજ્ઞાન માણસને ઈમામે ઝમાના
(અ.સ.) વિશેનું માર્ગદર્શન આપવું તે ૧૦૦

વર્ષની સાચી અને કબુલ થયેલી ઇબાદત કરતાં વધારે સારું કામ છે. અઘાહની નજરોમાં એવો માણસ (એટલે કે લોકોને ઇમામ પ્રત્યે માર્ગદર્શન આપનાર માણસ) ની હાજરી ૭૦ મોમીનો કરતા વધારે સારી છે. ઉપરોક્ત હદીસથી આપણે નીચે મુજબના વાતના તારણ ઉપર આવી શકીએ.

(૧) શક્ય હોય ત્યાં સુધી આપણી શક્તિ અને ક્ષમતા મુજબ એહલેબૈત (અ.મુ.સ.)ના શિયાઓની મુશ્કેલીઓનું નિવારણ કરવાની અને તેમને મદદ કરવાની પુરી કોશિશો કરવી જોઈએ.અઘાહ તઆલા અને અઈમ્મા (અ.મુ.સ) ખાસ કરીને ઇમામે

ઝમાના (અ.સ.)ની ખુશી મેળવવાનો આ સૌથી સારો રસ્તો છે.

(૨) શિયાઓને ઈમામે ઝમાના (અ.સ.) પ્રત્યેની મોહબ્બતનું માર્ગદર્શન આપવું એ પણ શિયાઓને મદદ કરવાનો એક રસ્તો છે. સ્વાભાવિક રીતે માર્ગદર્શન આપવાના આ કામમાં આપણા બાળકો,કુટુંબીજનો સગાઓ અને મિત્રોનો પણ સમાવેશ થઈ જાય છે.(૩) ઈમામે ઝમાના (અ.સ.) ની મોહબ્બત તરફ માર્ગદર્શન આપવું એ એકસો વર્ષની સહીહ અને કબુલ થએલી ઈબાદત સમાન છે-જે કોઈ આ કામ કરે છે તે અદ્વાહની નજરોમાં સિત્તેર મોમીનો કરતા ઉચ્ચતા ધરાવે છે.

(૪) આપણી બેઠકો (મજલીસ,મીટીંગ વગેરે) ઈમામે ઝમાના (અ.સ.) ની યાદથો ખાલી ન હોવી જોઈએ.

(૫) સૈયદ ઈબ્ને તાઉસ અ.ર. તેમની કિતાબ ‘ઈકબાલ’ ના ભાગ-૧, પાના નં.૪૫૭ઉપર સુરએ અસ્રની તફ્સીરમાં સુરાની છેલ્લી આયત ‘વ-તવા-સવ-બિલ-હકકે-વ-તવા-સવ-બિસ્સબ્ર’ ના અર્થમાં ફરમાવે છે કે આપણા ઉપર ઈમામે ઝમાના (અ.સ.)ના જે હકકો છે,તેની યાદી એક બીજાને દેવરાવવી જોઈએ.

કિસ્સો - ૨૬

ઈમામે ઝમાના (અ.સ.) ની ખુશી માટે
ખર્ચ કરવો.

(૧) ઈમામે જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે કે કોઈ મોમિન સાચા દિલથી એક દીરહમ ઈમામ (અ.સ.) ની રાહમાં ખર્ચ કરે, તેના કરતા વધુ પસંદ કરવા લાયક બીજો કોઈ અમલ અદાહની નજરોમાં નથી. કયામતના દિવસે અદાહ તઆલાએ દિરહમને સાક્ષી બનાવશે. ત્યાર પછી ઈમામ (અ.સ.)એ સુરએ બકરહની આયન નં. ૨૪૫ ની તિલાવત કરી. “છે કોઈ એવો જે અદાહને કર્ઝે હસના આપે કે જેથી અદાહ તેને અસંખ્ય ગણુ વધારી આપે; અને અદાહ જ રોજી તંગ

કરે છે અને વિશાળ કરે છે, અને તેની જ તરફ તમારું પાછું ફરવું થશે.” (સુરએ બકરહ : આ.૨૪૫) (ઉસુલે કાફી ભાગ-૨ પાના નં.૧૫૬ હદીસ નં.૨૮)

(૨) ઈમામ જાફર સાદિક (અ.સ.) ફરમાવે છે કે ઈમામ (અ.સ.) ની રાહમાં એક દીરહમ ખર્ચ કરવો એ તમામ મોમીનો માટે ૨૦ લાખ (બે મિલિયન) દીરહમ ખર્ચ કરવા બહેતર છે.(ઉસુલે કાફી,ભાગ-૨ પાના નં.૧૫૬ હદીસ નં.૨૮)

(૩) ‘મન લા યહઝૂલ ફકીહ’ નામની કિતાબમાં ઈમામે સુ.બકરહની આયત નં.૨૪૫ સમજાવતા ફરમાવ્યું કે : ઈમામ (અ.સ.) ની રાહમાં એક દીરહમ દસ લાખ

દીરહમ ખર્ચ કરવા કરતા બહેતર છે. આં
હઝરત (સ.અ.વ) એ આગળ ફરમાવ્યું :
હજજ માટે એક દીરહમ ખર્ચ કરવો એ બીજા
કામોમાં દસ લાખ દીરહમ ખર્ચ કરવા કરતાં
બહેતર છે. અને એકે એક દીરહમ જે ઇમામ
(અ.સ.) ને પહોંચે તે હજ માટે ખર્ચવામાં
આવેલા દસ લાખ દીરહમ કરતાં બહેતર છે.
(ઉસુલે કાફી ભાગ-૨, પાના નં.૨૬૦ હદીસ
નં.૩૧)

(જ) આયતુદ્દાહ સૈયદ મોહમ્મદ તકી
મુસવી ઇસ્ફહાની ‘મીકીયાલુલ મકારીમ’
નામની કિતાબની ફારસી આવૃત્તિના બીજા
ભાગના પાના નં.૩૫૭ ઉપર

લખે છે કે : ગયબતના ઝમાનામાં ઈમામે ઝમાના (અ.સ.) ની રાહમાં ખર્ચ કરવાનો અર્થ એ છે કે એવા કામોમાં ખર્ચ કરવો કે જે ઈમામ (અ.સ.) ની ખુશી,તાબેદારી અને મોહબ્બતનું કારણ હોય. (ખાસ કરીને ઈમામે ઝમાના (અ.સ.) વિશેની કિતાબો પ્રકાશીત કરવી) અથવા એવા કાર્યક્રમોનું આયોજન કરવું જેમાં ઈમામે ઝમાના (અ.સ.) ને યાદ કરવામાં આવતા હોય. તમામ નેક કામોમાં ઈમામે ઝમાના (અ.સ.) ને અગ્રતા આપવી.

સૈયદ ઈબ્ને તાઉસ તેમની કિતાબ કશકુલ મોહજહના પાના નં.૧૫૧/૧૫૨ પર તેમના ફરઝંદને વસીયત કરતા સલાહ આપે છે કે હંમેશા તમારા કામોમાં ઈમામે ઝમાના

(અ.સ.) ને અગ્રતા આપો. તમે જ્યારે નમાઝે હાજત પડો કે સદકો આપો ત્યારે ઇમામે ઝમાના (અ.સ.) ની ખુશ્નુદી માટે અને સલામતી માટે નમાઝ પડો અને તેઓ (અ.સ.) વતી સદકો પણ આપો. ટુંકમાં તમારા દરેક નેક કામોમાં ઇમામે ઝમાના (અ.સ.) ને યાદ કરીને તેમના વતી નેક કાર્ય કરો. એ વાતમાં શંકા નથો કે તમારા આ કામથી તમારા પર ઇમામ અ.સ. ની ખાસ નઝરે ઇનાયત રહશે. એક માણસને ઇમામે સાદિક (અ.સ.) ને પુછ્યું કે : જો કોઈ માણસ બીજા કોઈ માણસ વતી હજ બજાવી લાવે તો તેનો બદલો શું મળશે? ઇમામે (અ.સ.) જવાબ આપ્યો કે તેને દસ હજજ સમાન

બદલો મળશે. ઇતિહાસ એ હકીકત સાક્ષી
આપે છે કે ઇમામ (અ.સ.) પાસે જ્યારે પણ
કોઈ એ મદદ માગી ત્યારે ઇમામે (અ.સ.)
તેની અપેક્ષા કરતાં ઓછું ક્યારેય પણ આપ્યું
ન હતું.(ફુરુએ કાફી,ભાગ -૪,પાના નં.૩૧૨
હદીસ નં.૨)

સૈયદ ઇબ્ને તાઉસની ઉપર જણાવલી
વસીયત એ વાતની સાબિતી આપે છે કે
આપણા આપણા તમામ નેક કાર્યોમાં ઇમામે
ઝમાના (અ.સ.) ને અગ્રતા આપવી જોઈએ.
આમ કરવાથી ઇમામ (અ.સ.) ની ખુશી
મેળવી શકાશે. એટલું જ નહીં પરંતુ આપણા
કામો કબુલીયતના દરજજે પહોંચશે અને
મહાન સવાબ મળવાને પાત્ર બનશે.

ક્રિસ્તો - ૨૭

ઈમામ (અ.સ.) ને દિલથી યાહવા અને
કલામ થકી

ઈમામ (અ.સ.) ની મદદ કરવી

એહલેબૈત (અ.સ.) પર આપણી જાન
કુરબાન થાય કે જેઓએ આપણને જત્રતનો
આસાન રસ્તો બતાવ્યો છે. આ વિષયના પણ
અનેક પાસાઓ છે.

જેમાંથી આ નાનકડી પુસ્તિકામાં વધુમાં વધુ
પાસાઓ આવરી લેવાનો પ્રયત્ન
કરવામાં આવશે.

એહલેબૈત (અ.સ.) ના દુશ્મનોથી દૂર રહેવું.

(૧) પયગમ્બર (સ.અ.વ.) એ હઝરત
અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ને ફરમાવ્યું કે

: “અય અલી, તમે મારા પછી તમામ મોમીનોના મૌલા છો, તમો તમામ મખ્લુક પર અદ્લાહની હુજ્જત છો. બેશક જે લોકો તમારી વિલાયતને કબુલ કરશે તેઓ માટે જન્નત છે અને જે લોકો તમારી વિલાયતનો ઈન્કાર કરશે તેમના માટે જહન્નમ વાજીબ છે.” (૨) “અય અલી એ ઝાતની કસમ કે જેણે મને પયગમ્બર બનાવીને મોકલ્યો છે કે જે કોઈ એક હજાર વર્ષ સુધી અદ્લાહની ઈબાદત કરે તો પણ તેનો અમલ ત્યાં સુધી કબુલ કરવામાં નહીં આવે કે જ્યાં સુધી તે તમારી તથા તમારા એહલેબૈત(અ.સ.)ની વિલાયતનો સ્વિકાર ન કરે અને તમારા દુશ્મનોથી દૂરી ઈપ્તેયાર ન કરે. અય અલી, આ હદીસ જીબ્રઈલ મારી પાસે

વહીરૂપે લાવ્યા. હવે તમે જે લોકોને પસંદ કરો તેને સ્વીકારો અને જે લોકો ન ચાહતા હો તેને દૂર કરો.(રસુલ સ.અ.વ.)

(૩) ઈમામ જાફર સાદિક (અ.સ.) ફરમાવે છે કે : જે કોઈને અમારા શત્રુઓના કુદ્ધ વિશે અને અમારી ઉપર ઝુલ્મ કરનારાઓ વિશે શંકા હોય તો તેવા લોકો પોતે જ ‘કાફીર’ છે. (વસાએલુશ્શીયા,ભાગ-૧૮ પા.૫૬૧)

(૪) આ વિષય પરની એક હદીસમાં ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) તેમાના શિયાઓને હુકમ આપતા ફરમાવે છે કે : તમારી વાજબ નમાઝો પુરી થવા પછી તમારી જગ્યાઓથી બની ઉમર્યા પર લાનત કરવા

પહેલા હટશો નહીં (શૈખ તુસી કૃત તેહઝીબુલ
ઈમામ ભાગ-૨ પા.૧૦૯ હદીસ નં.૧૦૯)

(૫) ઈમામ હસન અસ્કરી (અ.સ.) એ
ફરમાવ્યું : અમારા દુશ્મનો પર લાનત કરનારા
લોકોનો અવાજ ફરીશ્તાઓ આસમાન પર લઈ
જાય છે. ત્યાર પછી તે ફરીશ્તાઓ પણ અમારા
દુશ્મનો પર લાનત મોકલે છે. પછી એ
ફરીશ્તાઓ એ માણસના વખાણ કરે છે અને
તેના માટે ઈસ્તગફાર કરીને તેના માટે
અદ્દાહની રહમતની દુઆ માંગે છે. ફરીશ્તાઓ
અદ્દાહ પાસે એ માણસ ઉપર રહમત
મોકલવવાની દુઆ કરતા કહે છે. કે : આ બંદા
એ તારી હુજ્જતની મદદ કરવા માટે તેનાથી
બનતા પ્રયત્નો કર્યા છે. જો તે આનાથી વધારે

કાંઈ કરી શકતો હોય તો તે પણ કરત. તે વખતે અલ્લાહ તઆલા ફરમાવે છે કે : અય ફરીશ્તાઓ ! મેં આ માણસ માટે તમારી દુઆઓને કબુલ કરી છે. મારી નેઅમતો અને રહેમતો તેના પર નાઝીલ કરી છે. અને હું તેને મારા મુત્તકી અને મહાન બંદાઓમાં શામીલ કરી દર્શા.(બેહારૂલ અનવાર : ભાગ: ૫૦ પા.૩૧૭)

(૬) જનાબ અબુ હમઝા શેમાલી ચોથા, પાંચમાં અને છઠ્ઠા ઈમામ (અ.સ.) ના ઝમાનામાં ઈમામ (અ.સ.) ના સહાબી હતા.ઈ.ઝયનુલ આબેદીન (અ.સ.) ને એમ ફરમાવતા સાંભળ્યું કે જે કોઈ દિવસમાં એક વખત ‘જુબ્ત અને તાગુત’ પર લાનત કરે તો

અઘાહ તઆલા તેના માટે ૭૦,૦૦,૦૦૦ (સિતેર લાખ) નેકીઓ લખે છે. અનેતેના ૭૦,૦૦,૦૦૦ (સિતેર લાખ)ગુનાહ માફ કરે છે તેમજ તેના દરજજા ૭૦,૦૦૦૦૦ ગણા વધારી દે છે. જો તે રાતના સમયે એક વખત લાનત કરેતો પણ તેના માટે ઉપર મુજબનો બદલો લખવામાં આવશે. અબુ હમઝા શેમાલી કહે છે કે ઈમામે ઝયનુલ આબેદીન (અ.સ.) ની શહાદત પછી,મેં ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ની ખિદમતમાં ઉપરની હદીસ રજુ કરીને એ હદીસની છણાવટ કરવાની વિનંતી કરી. ત્યારે ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) એ મારી પાસેથી આ હદીસ સાંભળીને ફરમાવ્યું કે : તમે ઈચ્છો છો હું આ બદલામાં

વધારો કંઈ? તો સાંભળો તમે કોઈ તે (જીવ્ત અને તાગુત)ની ઉપર સવારના સમયે લાનત કરો તો તેના એ દિવસના ગુનાહોને લખવામાં નહીં આવે અને જો તે સાંજના સમયે લાનત કરશે તો તેના રાતના સમયના ગુનાહ નોંધવામાં નહીં આવે. અબુ હમ્ઝા શેમાલી કહે છે કે : ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ની શહાદત પછી હું ઈમામ જાફર સાદિક (અ.સ.)ની ખિદમતમાં રજુ થયો અને મારા માટે આ હદીસનું વિવરણ કરી આપવાની વિનંતી કરી. ત્યારે છઠ્ઠા ઈમામ અ.એ સવાબમાં વધારો કરતા ફરમાવ્યુ:બેશક અદ્દાહ તઆલા ખુબ જ ઉદાર છે. અને મહાન ખૂબજ

મોટો બદલો આપનારો છે. (શેફાએ સુદુર ભાગ-૨ પા.૩૭૯)

ઉપરોક્ત હદીસમાંથી નીચે મજબના અગત્યના તારણો નોંધવા જેવા છે.

(૧) મોટા ભાગના શિયાઓ ‘જીબ્ત અને તાગૂત’ થી પરિચિત છે. તથા આ શબ્દોથી ઓળખાતી વ્યક્તિઓને જાણે છે. જે લોકો આ શબ્દથી પરિચિત ન હોય તેઓએ આલિમોનો સંપર્ક કરવો જોઈએ.

(૨) ઉપરની હદીસમાં ગુનાહો માફ થવાની જે વાત દર્શાવવામાં આવી છે તે એવા ગુનાહોની વાત છે કે જે ભૂલથી થયા હોય અથવા બળજબરીપૂર્વક કરાવવામાં આવ્યા હોય. આપણામાંથી કોઈએ એમ માની લેવું ન

જોઈએ કે ‘જીવ્ત અને તાગુત’ પરની લાનત દિવસ અને સાંજના સમયે મનફાવે તેવા ગુનાહો કરવાની પરવાનગી આપે છે. અને તે ગુનાહોની કોઈ સજા આપવામાં નહીં આવે, તેવું પણ માની લેવું ન જોઈએ.

(૩) આપણા બાળકોને આપણે અઘ્ઘાહ એક હોવા વિશેની વાત (તોહીદ) બાર ઈમામ (અ.સ.) અને ચોદ માસુમીન (અ.સ.) વિશેની તાલીમ આપીએ છીએ. તેવી જ રીતે આપણે બાળકોને એહલેબૈત (અ.સ.)ના દુશ્મનોથી પણ વાકેફ કરવા જોઈએ. અને ત્યારે જ આપણું ઈમાન સંપૂર્ણ થશે.

કિસ્સો - ૨૮

પવિત્ર ઇમામો (અ.મુ.સ.) ની પ્રશંસામાં કલામ રચવા

(૧) ઇમામે સાદિક (અ.સ.) એ ફરમાવ્યું કે જે કોઈ ઇમામ (અ.સ.)ની પ્રશંસામાં અશઆર પઢે તો અલાહ તેને જન્મતમાં એક ઘર અતા કરશ. (વસાએલુશીયા ભાગ - ૧૦ પા.૪૩૭ હદીસ ૧)

(૨) બીજી એ હદીસમાં છઠ્ઠા ઇમામ (અ.સ.) એ ફરમાવ્યું : કોઈપણ માણસ એ સમય સુધી ઇમામની પ્રશંસામાં અકીદત કલામ કહી શકતો નથો કે જ્યાં સુધી તેને (તેનાએ કાર્ય માટે) રૂહુલ કુદસની મદદ

હાંસિલ ન થઈ હોય. (વસાએલુશશીયા ભાગ-
૧૦ પાના નં.૪૬૭ હદીસ ૨)

(૩) ઈમામે રેઝા (અ.સ.)એ ફરમાવ્યું કે જે કોઈ અમારી ફઝીલતને પોતાના કલામ થકી વ્યક્ત કરે તો અદ્લાહ તેને જન્નતમાં એક મકાન અતા કરશે, જેનું કદ આ દુનિયાના કદ કરતા સાત ગણું મોટું હશે.અદ્લાહ અને તેના પયગમ્બરોની નઝદીકી ધરાવતા તમામ ફરીશ્તાઓ આ મકાનમાં તે શાયરને મળવા માટે આવશે. (વસાએલુશશીયા ભાગ-૭ પાના.૪૬૭ હદીસ નં.૩)

(૪) કુમૈલ ઈબ્ને ઝૈદલદી કહે છે કે : હું ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ની ખિદમતમાં હાજર થયો. આપે (અ.) મને

સંબોધીને કહ્યું : અચ કુમૈલ જો મારી પાસે આખી દુનિયાનો ખજાનો હોત તો તેમાંનો મોટો હિસ્સો હું તમને આપી દેત.આમ છતાં હું તમારી પાસે એ શબ્દો દોહરાવું છું,જે ઇમામ (અ.સ.) એ હસ્સાન ઇબ્ને સાબિતને કહ્યા હતા કે જ્યાં સુધી તમે અમારી ફઝીલતમાં કહેલા અકીદત કલામ પઢતા રહેશો રૂહુલકુદુસ તમને મદદ કરતા રહશે. (રઉઝાએ કાફી ભાગ-૮ પા ૧૦૨)

અહીં સવાલ એ થાય કે જો કોઈ પાસે અકીદત કલામ કહેવાની આવડત કે ક્ષમતા ન હોય તો તેવા માણસે શું કરવું જોઈએ? એ સંજોગોમાં તે માણસે ઇમામ (અ.સ.) ની શાનમાં ઇમામ (અ.સ.) પ્રત્યેની મોહબ્બતના

પ્રતિકરૂપે કહેવાએલા અકીદત કલામ (કાવ્યો) એકઠા કરવા જોઈએ. શાયરો એ વાત સારી રીતે સમજી શકશે તેઓ તેમના કલામ રૂહુલ કુદ્સની મદદ થો જ રચી શકે છે લોકોના સમૂહની વચ્ચે-મુશાયરામાં જયારે અકીદત કલામને દાદ આપવામાં આવે ત્યારે તેમણે એ મદદનો શુક્ર અદા કરવો જોઈએ. આ રીતે શુક્ર અદા કરવાથી તે શાયરની પ્રતિષ્ઠામાં કોઈ ઘટાડો થતો નથી. બલકે તેની તોફીક અનેઅજ્રમાં વધારો થાય છે.

આ તબક્કે તમામ શાયરે એહલેબૈત (અ.સ.) બિરાદરોને વિનંતી છે કે ઈમામે ઝમાના (અ.સ.) ની શાનમાં કહેવાએલા અકીદત કલામની જે કિતાબો છે, તેને વધુમાં

વધુ સંખ્યામાં પ્રસિદ્ધ કરાવી ,તેનો પ્રચાર કરવાના વધુમાં વધુ પ્રયત્નો કરવા. આપણે એ વાત સારી રીતે જાણીએ છીએ કે મઝહબના પ્રચારમાં એહલેબૈત (અ.સ.) ની ફઝીલતમાં અકીદત કલામ રચનારા શાયરોએ અગત્યનો ભાગ ભજવ્યો છે. તેથી જ તેઓ જ તેઓ લાકોના દિલમાં ઈમામે ઝમાના(અ.સ.) પ્રત્યેની મોહબ્બત પૈદા કરવા માટે મહત્વનો ભાગ ભજવી શકે છે.

(OUR DUTIES TOWARDS IMAM A.T.F.S.)

કિસ્સો - ૨૯

ઈમામ (અ.સ.) માટે દુઆ કરવી

“મીકીયાલુલ મકારીમ ફી ફવાએદલ દુઆ લીલ કાએમ” નામની તેમની કિતાબમાં આયતુદ્દાહ સૈયદ તકી ઈસ્ફહાનીએ ઈમામે ઝમાના(અ.સ.)માટે દુઆ કરવાના કારણો અને તેમની થતાં ફાયદાઓનું વિગતવાર વર્ણન કરેલ છે. મીકીયાલુલ મકારીમ નામની આ મોટી કિતાબના બે ભાગ છે જેમાં લેખકે ઈમામે ઝમાના (અ.સ.) માટે દુઆ શા માટે કરવી જોઈએ? તે વાતને જુદા જુદા ૧૧૦ કારણો આપીને રજુ કરી છે. અને ઈમામ

(અ.સ.) માટે દુઆ કરવા જરૂરત પ્રત્યે આપણને જાગૃત કર્યા છે. તેમજ ઈમામ (અ.સ.) માટે દુઆ કરવાથી દુનિયા અને આખેરતના ૯૦ ફાયદાઓનું વર્ણન પણ કર્યું છે. ખુદ ઈમામે ઝમાના (અ.સ.) એ ફરમાવ્યું છે કે : મારા ઝહુર માટે વધારે દુઆ કરો. (કમાલુદ્દીન ભાગ-૨, પા.૪૮૫ પાના.૨૮૪)

ઈમામે જઅફર સાદિક (અ.સ.) એક હદીસમાં ફરમાવે છે કે : જ્યારે બની ઈસ્રાઈલ (નામની કોમ) ને ફીરઓનના ઝુલ્મ અને અત્યાચારથી બચવાની અને તેમની સમસ્યાઓના નિવારણની કોઈ આશા ન રહી, ત્યારે તેઓ બધા જંગલમાં એકઠા મળ્યા અને અલ્લાહ તઆલા પાસે રૂદન તથા આજીજી

કરીને મદદ માટે દુઆ કરી.આ દુઆનું પરિણામ એ આવ્યું કે : અદાહ તઆલાએ (તે કૌમને મદદગાર બનનાર) હ.મુસા (અ.સ.) ની વિલાદત ૪૦૦ વર્ષ વહેલી કરી. ઈમામે (અ.સ.) આગળ ફરમાવ્યું : મારો ફરજદ પણ એ સમય સુધી ઝહુર નહીં ફરમાવે કે જ્યાં સુધી (આખરી ઝમાનાના) શિયાઓ તેમના માટે દુઆ નહીં કરે.

કિસ્સો - ૩૦

ઈમામે ઝમાના (અ.સ.) માટે દુઆ કરવાના કેટલાક ફાયદાઓ.

(૧) દુઆ કરનાર તેના કાર્યોના હિસાબ વગર જન્મતમાં પ્રવેશ મેળવશે.

(૨) તેને કયામતના દિવસની પ્યાસથી રક્ષણ મળશે.

(૩) તે અઘાહ સુબ્હાનહુ વ તઆલા માટે ગર્વરૂપ બનશે.

(૪) તે અઘાહના ગઝબથી સુરક્ષિત રહેશે.

(૫) ફરીશતાઓ તેના માટે દુઆ કરશે.

(૬) તેના માટે પવિત્ર ઈમામો (અ.સ.) દુઆ કરશે.

(૭) ઈમામ અ. માટે તેની દુઆ કરવાના કારણે તેની પોતાની દુઆઓ કબુલ થશે.

(૮) તે માણસ માટે ઈમામ ઝમાના (અ.સ.) ખાસ દુઆ કરશે.

(૯) અઘાહ સુબ્હાનહુ વ તઆલા તેના ઈમાનને ‘સંપૂર્ણ ઈમાન’ ગણાશે.

(૧૦) તેની ગણતરી મહાન શહીદોમાં થશે.

(૧૧) તે પવિત્ર ઈમામો (અ.સ.) ની શક્ષાત મેળવનાર બનશે.

(૧૨) તે ઈમામ (અ.સ.) ના સાથોદારોના સમૂહમાં શામીલ થશે.

(૧૩) તેને પયગંબર (સ.અ.વ.) ની સાથ રહીને કરવામાં આવતી જેહાદમાં

શહીદ થનાર જેટલો બદલો (સવાબ) મળશે.

(૧૪) દુઆ કરવાની સાથ ઈમામ અ.સ. પ્રત્યેની મોહબ્બતમાં વધારો થશે.

(૧૫) તેની આયુષ્ય લાંબી થશે.

(૧૬) તેના ગુનાહો નેકીમાં બદલાઈ જશે.

(૧૭) તે દુનિયાની અને લોકોના નુકશાન
(ખરાબી)થો બચી શકશે.

(૧૮) તે આખરી ઝમાનાના ભ્રષ્ટાચારથો
બચીને રહેશે.

(૧૯) આ દુનિયાની મુશ્કેલીઓથો તે
સુરક્ષિત રહેશે.

(૨૦) તેની રોઝીમાં વધારો થશે.

(૨૧) જો તે ઈમામે ઝમાના (અ.સ.) ની
હુકુમત પહેલા મુત્યુ પામશે તા તેને

(ઈમામ અ.સ.ની હુકુમત દરમ્યાન)
જીવતો કરવામાં આવશે.

(૨૨) તેને જાગૃત કે સુવાની હાલતમાં ઈમામે
ઝમાના (અ.સ.) ની મુલાકાત નો મોકો
(તક) મળશે.

(૨૩) તેના ગુનાહોને બક્ષી દેવામાં આવશે.

(૨૪) તે હિસાબના દિવસે (ક્યામતમાં) મોમીનોની શફાઅત કરી શકશે.

(૨૫) આ દુનિયામાં તેને પોતાના મા-બાપ સાથે નેક વર્તન કરવાનો બદલો મળશે. વહાલા ભાઈઓ, અહીં ઈમામે ઝમાના (અ.સ.) માટે દુઆ કરવાના ફકત

અમુક ફાયદાઓ જ રજુ કરવામાં આવ્યા છે. આવા અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા ફાયદાઓને કુરઆનની આયતો અને પવિત્ર ઈમામો (અ.સ.)ની હદીસોનું સમર્થન મળેલું છે. હકીકતમાં આપણું સદ્ નસીબ છે કે માટે દુઆ કરવાની તોફીક મળવા અને તેમાં વધારો થવા માટે

નિષ્ઠાપૂર્વક દુઆ કરવી જોઈએ. તમામ લોકોને આ તૌફીક મળતી નથી. ચાલો, આપણે અદાહ સુબ્હાનહુ વ તઆલા પાસે માઅસુમ ઈમામો (અ.) ને વસીલો બનાવીને દુઆ કરીએ કે તે આપણને ઈમામે ઝમાના (અ.સ.) માટે દુઆ કરવાની તૌફીક અતા કરે. (આમીન) હવે સવાલ એ થાય કે ઈમામે ઝમાના (અ.સ.) માટે દુઆ કઈ રીતે કરવી? અલબત, આપણા પોતાના શબ્દોમાં પણ ઈમામ (અ.સ.) માટે દુઆ કરી શકીએ છીએ. અથવા તો બેહતર એ છે કે પવિત્ર ઈમામો (અ.સ.) માટે સૂચવેલી દુઆઓ કરીએ. અહીં ઈમામો (અ.સ.) ની કેટલીક દુઆઓના નામ અને તેની પ્રાથમિક

વિગત પ્રસ્તુત કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આ દુઆઓ પડવાથી દુઆઓનો ફાયદો મળી શકશે. આ ઉપરાંત આ દુઆઓ થકી રૂહોને તાજગી મળશે. તેમજ ઈમામ (અ.સ.) ના વહેલા ઝહુર થવા માટે વારંવાર દુઆ કરવાનો ઉત્સાહ જાગશે. **(Our duties towards Imam a.s.)**

ફિરસો - ૩૧

ઈમામે ઝમાના (અ.સ.) માટે કેટલીક દુઆઓ.

(૧) દુઆએ ફરજ અલાહુમ્મ કુદ્દે વલીય્એક..... આ દુઆ દરરોજની વાજીબ નમાઝની કુનુતમાં પડવી મુસ્તહબ છે. શૈખઅબ્બાસે કુમ્મી ‘મુનતહીયુલ અઅમાલ’

નામની કિતાબમાં લખે છે કે : ત્રીજી શબે કદર એટલે કે ૨૩ મી માહે. મુબારકે રમઝાનની રાતે અદાહની હમ્દ અને પવિત્ર ઈમામ પર સલવાત મોકલ્યા બાદ આ દુઆ અદાહહુમ્મ કુદ્દે વલીય્હેક....પડવાનું ચુકવું ન જોઈએ. હકીકતમાં હાલતાં-ચાલતાં સૂતાં-બેસતાં, હમેશા આ દુઆ દરેકે પડવી અત્યંત જરૂરી છે.

(૨) દુઆએ ગરીક : ઈમામે સાદિક (અ.સ.) એ જ્યારે ઝોરારહ નામના સહાબીને ઈમાનના અંતિમ સમયનો વિગતો સમજાવી ત્યારે ઝોરારહે ઈમામ અ.ને પુછ્યું કે : જો કોઈના જીવનનો અંતિમ સમય હોય તો તે હાલતમાં તેણે પોતાનું ઈમાન કેવી

રીતેસલામત રાખવું જોઈએ ? ઈમામે ફરમાવ્યું કે : તેણે પોતાની જીંદગીમાં “દુઆએ - ગરીક” સતત-અને અવારનવાર પડતા રહેવી જોઈએ. એ દુઆ આ પ્રમાણે છે. દુઆએએ ગરીક : યા અદ્દાહો યા રહમાનો યા રહીમ. યા મોકદ્દેબલ કોલુબ. સબ્બીત કલ્બી અલા દીનેક. (મુનતહિયુલ અઅમાલ)

(૩) દુઆએ અહદ : ઈમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે કે જો કોઈ ૪૦ દિવસ સુધી નમાઝે સુબ્હ પછી આ દુઆએ અહદ- પડે તો તે ઈમામે ઝમાના (અ.સ.) ની હુકુમતના ઝમાના સુધી અવશ્ય પહોંચશે. અને કદાય જો તે પહેલા તેનો ઇન્તેકાલ થઈ જશે તો ઝહુરના સમયે ઈમામ (અ.સ.) તેને

કલ્પમાંથી ઉભો કરશે. આ ઉપરાંત આ દુઆના દરેક શબ્દના બદલામાં અઘાહ સુબ્હાનહુ વ તઆલા દુઆ પડનાર માટે ૧૦૦૦ નેકીઓ લખે છે. અને ૧૦૦૦ ગુનાહો માફ કરે છે. (બેહારૂલ અન્વાર ભાગ - ૧૦૨, પા.૧૧૧)

આવો, આજથી જ આપણે બધા સાથે મળીને એ વાતનો નિર્ણય કરીએ કે દરરોજ સવારે સુબ્હની નમાઝ બાદ આ દુઆ પડીશું. આ દુઆ પડવામાં દસ મિનિટ કરતાં વધારે સમય લાગતો નથી. આ ઉપરાંત નમાઝે જમાઅત થતી હોય તેવી મસ્જીદોમાં આ દુઆની તિલાવત સામૂહિક રીતે કરાવવાના પ્રયત્નો કરવા જોઈએ.

(૪) દુઆએ નુદબહ : દર શુક્રવારે આ દુઆ પડવાની ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ તાકીદ ફરમાવી છે. નુદબહ શબ્દનો અર્થ થાય છે રડવું. જુમ્આના દિવસ ઈમામે ઝમાના (અ.સ.)ના દિવસે ઈમામે ઝમાના (અ.સ.)ને ચાહનારાઓ તેમના આકા - ઈમામે ઝમાના (અ.સ.)ને દુઆએ નુદબહ થકી સંબોધન કરી બોલાવે છે. આ દુઆના શબ્દો હૃદયને સ્પર્શી જાય તેવા છે. પ્રત્યક્ષ અનુભવ દુઆની તિલાપત (કરી તેના અનુવાદ તરફ ધ્યાન આપ્યા પછી જ થાય છે.)

(૫) દુઆ દર ગૈબતે ઈમામે ઝમાના (અ.સ.) : શૈખ અબ્બાસે કુમ્મીએ આ દુઆને

ઈમામ (અ.સ.) ના ખાસ નાઅેબોના હવાલાથો નોંધી છે. તેઓ ફરમાવે છે કે : જો તમને જુમ્આના દિવસે કોઈ નેક કામ કરવાની તક ન મળે તો આ દુઆની તિલાવત તો જરૂર કરજો. આ દુઆ મફાતિહુલ જુનાન નામની કિતાબમાં છે. જેની શરૂઆતના શબ્દો આ પ્રમાણે છે. :અલ્લાહુમ્મ અરરીફની નફસક.....

(૬) ઝિયારતે આલે યાસીન : ઈમામે ઝમાના (અ.સ.) ફરમાવે છે કે : જ્યારે તમે બોલવવા યાહો ત્યારે આ ઝિયારત પડીને મને બોલાવો. આ દુઆ પણ મફાતિહુલ જુનાનમાં ઝિયારતના વિભાગમાં સરદાબની ઝિયારત ના મથાળા હેઠળ આપવામાં આવી છે. જેની

શરૂઆતના શબ્દો આ પ્રમાણે છે.....
સલામુન અલા આલે યાસીન.

(૭) અબુ ઝરબ ઈસ્ફહાનીની સલવાત ઈમામે ઝમાના (અ.સ.) એ આ સલવાત દર જુમ્આની અસ્રની નમાઝ પછી પડવાની ભલામણ કરી છે. ઈમામે ઝમાના (અ.સ.) એ પોતે આ સલવાત અબુ ઝરબને તાલિમ ફરમાવી હતી. મફ્તિહુલ જુનાનમાં જુમ્આના દિવસે પડવાની ક્રિયારતના પ્રકરણમાં આપવામાં આવી છે.

(૮) જુમ્આના દિવસે પડવાની ઈમામે અસ્રની ક્રિયારત : આ ક્રિયારત પણ મફ્તિહુલ જુનાનમાં આપવામાં આવી

છે. અને દુઆએ નુદબાની કિતાબના પાછળના પેજ પર આપેલ છે.

(૯) ઈમામે રઝા (અ.સ.) એ ઈમામે ઝમાના (અ.સ.) માટે ફરમાવેલી દુઆઃ ઈમામે રઝા (અ.સ.) પણ ઈમામે ઝમાના (અ.સ.) માટે દર જુમ્આના દુઆ કરતા હતા. આ દુઆ મફાતિહુલ જીનાનમાં દુઆએ અહદ પછી આપવામાં અલાહુમ્મ અદફેહ અન વલીચ્ચેક.....

(૧૦) દુઆએ અલાહુમ્મ અસ્તેહ..... ઈમામ રઝા (અ.સ.)એ અલાહુમ્મ અસ્તેહ.....શબ્દોથી શરૂ થતી દુઆ નમાઝે અસ્રની કુનુતમાં પડવાની તાકીદ ફરમાવી છે.

(૧૧)દુઆએ ઈલાહી અઝોમલ બલા..... કફઅમી કહે છે કે આ દુઆ એક કૈદીને ઈમામે ઝમાના (અ.સ.) એ તાલીમ કરી હતી. આ દુઆ પડવા પછી તે કૈદીને છુટકારો મળેલ હતો.ચાલો, આપણે પણ “ગૈબતના ઝમાનામાંથી મુક્તિ” મેળવવા માટે આ દુઆ નિયમિત પડીએ. આ દુઆ મફ્તિહુલ જુનાનમાં આપવામાં આવેલી છે.જેના શરૂઆતના શબ્દો ઈલાહી અઝોમલ બલા..... છે.

(૧૨)અલ્લાહુમ્મર્ઝુકના તૌફીકતતા’અ.....‘મીસ્બાહ’ નામની કિતાબમાં કફઅમી લખે છે કે : ઈમામે ઝમાના (અ.સ.) તરફથી તાલીમ કરવામાં આવેલી

આ દુઆ આપણે વારંવાર પડવી જોઈએ. મફાતિહુલ જુનાનમાં ‘ઈલાહી’ અઝોમલ બલા....’ દુઆ પછી આ આપવામાં આવેલી છે. જેના શરૂઆતના શબ્દો. ‘અદ્દાહુમ્મર ઝુકના તોફીકત તાઅ.....’ છે. ઉપરાંત આ દુઆ મીકયાલુલ મકારીમ સારાંશ (ગુજ.)માં પાછળનાં પેજ ઉપર આપવામાં આવી છે.

(૧૩)સલામુદાહે

કામિલુત્તઆમ.....મફાતિહુલ જુનાનમાં અદ્દાહુમ્મરઝુકના તોફીકત તાઅ એ દુઆ પછી આપવામાં આવેલો અને સલામુદાહે કામિલુત્તઆમ.....એ શબ્દોથી શરૂ થાય છે.દુઆએ નુદબાની કીતાબ ની પાછળ ના પેજમાં આપેલ છે.

નઝમ

અબ તો ગયબતકા પરદા હટા દીજીએ
અબ તો જલ્વા નબીકા દીખા દીજીએ,
અબ તો દીદાર અપના કરા દીજીએ,
આઈએ આઈએ, વકતે ઈમદાદ હૈ,
આપસે હમ ફકીરોકી ફરિયાદ હૈ,
હમ ગરીબોકો અબ આસરા દીજીએ,
યા ઈમામે ઝમાં, યા ઈમામે ઝમાં...
હક છુપાને પે જો ભી રઝા મંદ હય,
દુશ્મને ફાતેમા કે જો હમદદ હય,
ઉઝ્કી નસ્લોકો મોલા મીટા દીજીએ,
યા ઈમામે ઝમાં, યા ઈમામે ઝમાં...
આપ વારીસ હૈ શેહકે અઝાદાર ભી,
ઔર અઝાદાર શેહકે મદદગાર ભી,

दुश्मनाने अळा को सजा दीज्जे,
या एमामे ङमां, या एमामे ङमां...

दुश्मनाने अली सर उठाने लगे,
ईर अळादारे शेहको सताने लगे,
उन पे शमशीरे हैदर यला दीज्जे,
या एमामे ङमां, या एमामे ङमां...

या एमामे ङमां, या एमामे ङमां,
या एमामे ङमां, या एमामे ङमां,
या एमामे ङमां, या एमामे ङमां,
सारी दुनिया के हाजत रवा आप है,
मीस्ल हैदर के मुश्कील कुशा आप है,
सबकी बीगडी को मौला बना दीज्जे,
या एमामे ङमां, या एमामे ङमां...

બુગ્ગે હૈદર મે રોશન હૈ જીતને ચિરાગ,
બાટતે હય જો ઘર ઘર અદાવતકી આગ,
ઉન ચિરાગો કો આ કે બુઝા દીજીએ,
યા ઈમામે ઝમાં, યા ઈમામે ઝમાં...
મસ્લહત ગર હમે આઝમાને મે હો,
આપકો દૈર મોલા જો આને મે હો,
ખ્વાબ મે અપની સુરત દીખા દીજીએ,
યા ઈમામે ઝમાં, યા ઈમામે ઝમાં...
હય 'ફરીદ' આપકે ઘરકા અદના ફકીર,
આપ યાહે તો પલભર મે કર દે અમીર,
ઉસ્કી કીસ્મતકો ભી જગા દીજીએ,
યા ઈમામે ઝમાં, યા ઈમામે ઝમાં...

नळ म

ओर बेकरार हो गये, टिलको जब करार आ
गया,
आंभ बंध की तो ये लगा, जाने धन्तेजार आ
गया.
उस घडीको याद करके हम, मुन्तळीर रहे जनम
जनम,
आपने कहा था आयेगे, हमको अेतजार आ
गया.
कुल भील गये यमन यमन, शाभ शाभ जन
गर्घ दुल्हन,
अब भीळा हुँ है ने पतन, हांसीले नहार आ
गया.

सर पे ताज है गदीर का, झर्न झर्न ज़ेबरी
अदा,
अेक नया नया सा मुर्तजा, ले के ङुल्डीकार आ
गया.

ढेभकर जदीद अस्लहे, आप यु ही मुस्कुरा
पडे,
जेसे हुरमला के इभइ, कोध शिरप्पार आ
गया.

ले रहा है अलीका मेहजबी, धन्तेकामे पुने
शाहेदी,
पुद रसुल ने दुआअे दी, इतेमा को प्यार आ
गया.

हक को सरभलंद कर दिया, आप के अेक
गुलाम ने,

रुश्टीयो का हाल टेभकर, कुङ्को बुजार आ
गया.

एन्तेकामे शहे अजरर अली बाकी है....
अेक मयलती हुए तलवार अली बाकी है....
मरहबे अस्र को मालुम नहीं है शायद,
आजरी हैदरे करार अली बाकी है,
जंग अब्बासकी होनी है बशकले काअेम,
मुत्तपी जंगे अलमदार अली बाकी है.